

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૨૨ નવેમ્બર ૨૦૨૩, બુધવાર
વિક્રમ સંવત ૨૦૮૦, કારતક સુદ દશમ

વર્ષ : ૧૫
અંક : ૧૧૨

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુપ્રીમમાં સુનાવણી પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએ : સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ ૧૦૦ એફઆરઆઈ નોંધાઈ છે અને ૨ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત

નવી દિલ્હી, તા. ૨૧ । આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? કોર્ટે વધુમાં કહ્યું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન પંજાબના વકીલને પૂછ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે કડક પગલાં લઈ રહી નથી, જેના જવાબમાં પંજાબ સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે સરકારે પગલાં લીધાં છે જેમાં પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, લગભગ ૧૦૦ એફઆરઆઈનોંધી છે અને ૨ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. તેમજ અમારું સૂચન છે કે કેન્દ્ર અને તમામ રાજ્યોએ સમયસર સાથે મળીને કામ કરવું જોઈએ જેથી આગામી સિઝનમાં આ સ્થિતિ ઊભી ન થાય.

આગામી સિઝનની રાહ જોવાની જરૂર નથી : કોર્ટ



આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? અને વધુમાં કહ્યું હતું કે એફઆરઆઈ અને દંડ ઉપરાંત તેમને એમએસપીથી પણ વંચિત રાખવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જે કે એ વાત પણ સાચી છે કે જ્યારે પંજાબમાં એમએસપીમાંટે અન્ય રાજ્યોનું અનાજ વેચી શકાય છે, તો પછી એક ખેડૂતનું અનાજ બીજા ખેડૂતને કેમ ન વેચી શકાય? તેથી કદાચ આ ઉકેલ નહીં આવે. સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે બિહારના લોકો હજુ પણ મશીનોનો ઉપયોગ ઓછો કરે છે અને હાથથી જ લણાઈ કરે છે એટલે ત્યાં પરાળી સળગાવવાની ઘટનાઓ બહુ ઓછી છે. હવે આ મામલે આગામી સુનાવણી પછી ડિસેમ્બરના રોજ થશે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ સાથે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બરણ જિલ્લાના આંટા ખાતે જાહેર સભા કરી હતી.

ન્યૂઝ ડિસ્ક

છાત્રોની આત્મહત્યા માટે વાલીઓ જવાબદાર : સુપ્રીમ

નવી દિલ્હી, તા. ૨૧ । દેશના મુખ્ય કોચિંગ હાલ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના દર મહિને કિસ્સાઓ સામે આવે છે.

યુદ્ધવિરામના વિચારને ભારતે માનવહિતમાં આવકાર્યું

વોશિંગ્ટન, તા. ૨૧ । ઈઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે ગાઝા પટ્ટીમાં સર્જાયેલ તણાવમાં માનવતાવાદી પરિસ્થિતિના ઉલ્લંઘન પર યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં જણાવ્યું કે, ભારતીય નેતૃત્વનો સંદેશ સ્પષ્ટ અને તાર્કિક છે.

૪૧ મજૂરો ૧૦ દિવસથી ટનલમાં રહે છે : સુરંગમાં મજૂરો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ટનલના અંદરના સીસીટીવી ફુટેજ પહેલીવાર સામે આવ્યા

સોમવારે રાત્રે સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરો માટે ખીચડી અને દાળથી ભરેલી ૨૪ બોટલો મોકલવામાં આવી હતી

નવી દિલ્હી, તા. ૨૧ । પહેલીવાર ઉત્તરકાશીની સિલ્કચારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોની તસવીરો સામે આવી છે. જેમાં સુરંગમાં ફસાયેલા કામદારો જોવા મળે છે. સોમવારે, ટનલની અંદરના કાટમાળમાંથી છ ઈંચ પહોળી પાઈપલાઈન નાખવામાં આવી હતી, જેના દ્વારા મોટા પ્રમાણમાં ખોરાક મોકલવામાં આવ્યો હતો, જે દરમિયાન અંદર ફસાયેલા કામદારોની તસવીરો પણ જોવા મળી હતી. જેમાં તે જોઈ શકાય છે કે સુરંગમાં મજૂરો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે વોક્રી ટોકી દ્વારા ઘણી વાતો પણ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરો માટે ખીચડી અને દાળથી ભરેલી ૨૪ બોટલો મોકલવામાં આવી હતી. ૮ દિવસ પછી પ્રથમ વખત કામદારોને ગરમ ભોજન મળ્યું. આ ઉપરાંત નારંગી, સફરજન અને લીંબુનો રસ પણ મોકલવામાં આવ્યો હતો. આજે દળિયા અને અન્ય ખાદ્યપદાર્થો કામદારોને મોકલવામાં આવશે. અત્યાર સુધી માત્ર મલ્ટી વિટામિન્સ, પફડ રાઈસ અને ડ્રાય ફૂટ્સ પાઈપ દ્વારા મોકલવામાં આવતા હતા.

ખોરાક ૬ ઈંચ પહોળી પાઇપ દ્વારા કામદારો સુધી પહોંચાડવામાં આવ્યો



હાલમાં એજન્સીઓ બે યોજનાઓ પર કામ કરી રહી છે. પ્રથમ અમેરિકન ઓગર મશીન ટનલના કાટમાળમાં ૮૦૦-૯૦૦ મીમી સ્ટીલ પાઇપ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી આ પાઇપની મદદથી કામદારોને બહાર કાઢી શકાય. ઓગર મશીન વડે ૨૪ મીટરનું ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. બેકે, મશીનમાં ખામી સર્જાઈ હતી. આ પછી કામ અટકી ગયું. આજે ફરી ઓગર મશીન વડે ડ્રિલિંગ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ વર્ટિકલ ડ્રીલની પણ યોજના છે. આ માટે મશીન ટનલની ઉપર પહોંચી ગયું છે. આ મશીન આજે બપોરથી ખોદકામ શરૂ કરશે. તે ટનલની ઉપરથી ખોદવામાં આવશે, જેથી કામદારોને ઉપરથી સીધા જ બહાર લઈ જઈ શકાય. વાસ્તવમાં, ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલી સિલ્કચારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારદામ 'ઓલ વેધર રોડ' પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્માપાલ-ચમુનોગ્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ ૪.૫ કિલોમીટર લાંબી છે. ૧૨ નવેમ્બરે ટનલનો એક ભાગ વૃદ્ધી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે ૧૦ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ન્યૂયોર્કમાં એમી એવોર્ડ્સનું યોજાયો એકતા કપૂર ડિરેક્ટોરેટ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા

ન્યૂયોર્ક, તા. ૨૧ । સમારોહમાં ઓટીટીની દુનિયા પર પોતાના કન્ટ્રેન્ટ દ્વારા રાજ કરનાર ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર અને ક્રોમેડિયન વીર દાસને આ ઈન્ટરનેશનલ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતા કપૂર 'ડિરેક્ટોરેટ એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની ગઈ છે.

પાલિસ્તાની સમર્થકો લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે

ટોરેન્ટો, તા. ૨૧ । ભારત અને કેનેડા વચ્ચે પાલિસ્તાની સમર્થકોની પ્રવૃત્તિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાલિસ્તાની સમર્થકો હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર શેર કરતા લખ્યું છે કે કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે પાલિસ્તાન સમર્થકોએ સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ પાલિસ્તાન સમર્થકો સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ મામલે ચંદ્ર આર્યએ વધુમાં કહ્યું કે આ બંધુ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે.

વિશ્વભરમાં અનેક સ્થળે સતત ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ જોવા મળ્યો

કાબુલ, તા. ૨૧ । જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે ૪૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. તે જ સમયે, ૮,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો.

૨૬ નવેમ્બરે મુંબઈ પર આતંકી હુમલાના ૧૫ વર્ષ થશે ઈઝરાયેલે મુંબઈ પર આતંકી હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું


નવી દિલ્હી, તા. ૨૧ । ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેને દોહ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે અને આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે હવે ઈઝરાયેલે મુંબઈ આતંકવાદી હુમલાની ૧૫મી વરસી પહેલા જ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

સમાચાર પત્ર છે હોક્તંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કરે છે એક હોક્તંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ cnngujarat.com વેબસાઈટ ઉપર વિઝીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...



ઓસ્ટ્રેલિયા સામેની પરાજયથી ભારતીય ક્રિકેટફેન્સ નિરાશ હારને જીવનભર તો સાથે રખાય નહિ : કપિલ દેવ

1 નવી દિલ્હી, તા. ૨૧ ।

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ ભારતીય ટીમને પૂર્વ કેપ્ટન અને 1૯૮૩ વર્લ્ડકપ વિજેતા કપિલ દેવે સાંત્વના આવી હતી. તેમણે કહ્યું હતું કે હાર બાદ પોતાની ભૂલથી શીખીને આગળ વધવાનો સમય છે. કપિલ દેવથી પૂછવામાં આવ્યું હતું કે હાર બાદ ખેલાડીઓ દુખી છે. તમે તેમને શું કહેશો ? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'ખેલાડીઓએ

આગળ વધવું પડશે. જો તમને હારનો સામનો કરવો પડ્યો હોય તો તેને જીવનભર તમારી સાથે રાખો એવું ન કરવું જોઈએ. ખેલાડીએ આગળ વધવું પડશે. જે થયું તે બદલી શકાતું નથી. સખત મહેનત કરતા રહો. એક ખેલાડી હોવાનો આ જ અર્થ છે. તેઓએ ખરેખર સારું ક્રિકેટ રમ્યું હતું. હા, તેઓ છોલ્લી અડચણ પાર કરી શક્યા ન હતા. આપણે આ ભૂલમાંથી શું શીખી શકીએ તેના પર ધ્યાન આપવું છે.' કપિલ દેવ વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ન હતા. આ અંગે તેમણે હાલમાં જ કહ્યું હતું કે તેમણે ફાઈનલ માટે આમંત્રિત જ કરવામાં ન આવ્યો હતો.



ફાઈનલ બાદ મોદી ટીમ ઇન્ડિયાને મળ્યા તેના વીડિયો વાયરલ નરેન્દ્ર મોદીએ જાહેરાતે કહ્યું, બાપુ ટીલા ન પડતાં

1 અમદાવાદ, તા. ૨૧ ।

પીએમ મોદી ફાઈનલ શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર ટીમને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. વડાપ્રધાને નાખુશ રોહિતને મળીને કહ્યું કે, હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે. તેમ તમારું શાનદાર પ્રદર્શન આપ્યું છે. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ જાહેરાત સાથે ગુજરાતીમાં વાત કરી હતી. તેમણે જાહેરાત સાંત્વના આપતા કહ્યું કે, બાપુ ટીલા ના

પડતા.....તમે બધાએ તમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તમે લોકોએ 1૦ માંથી 1૦ ગેમ જીતી અહીં આવ્યા છો. આવું બધું રમતમાં થતું રહે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે રૂસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, 'અમારી ટુર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઈનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.'

ભારત સતત 1૦ મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યું હતું વર્લ્ડકપના ફાઈનલમાં હાર છતાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાનમાં જયજયકાર



1 નવી દિલ્હી, તા. ૨૧ । ભારતીય ક્રિકેટ ટીમ જે રીતે વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઈનલમાં પ્રવેશ કર્યો તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ ભારતીય ક્રિકેટનો ફેન બની ગયો છે. અલબત્ત, વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોવા છતાં અકરમ ભારતીય ક્રિકેટના વખાણ કર્યા અને કહ્યું કે પડોશી દેશનું ક્રિકેટ સારી સ્થિતિમાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટ જીત મેળવીને ભારતનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. વસીમ અકરમે કહ્યું, 'સ્વાભાવિક છે કે તેઓ (ભારતીય ટીમ) ફાઈનલમાં હારીને તૂટી ગઈ હશે પરંતુ ક્રિકેટમાં ભારતી ઘટનાઓ બનતી રહે છે. ભારતનો દિવસ ખરાબ હતો અને કમનસીબે

ફાઈનલમાં મળેલી હાર બાદ ગિલનું છલકાયું દર્દ અમે હારી ગયા હોઈએ, પણ હાર પછી બધું ખતમ નથી થતું

1 નવી દિલ્હી, તા. ૨૧ । વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટ હરાવ્યું હતું. આ હારથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા. આ સિવાય ખેલાડીઓના ચહેરા પર હારનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે, ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે હાર બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. શુભમન ગિલની પોસ્ટમાં તમામ ભારતીય ખેલાડીઓ જોવા મળે છે. શુભમન ગિલે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે લગભગ 1૬ કલાક વીતી ગયા છે, આ બધું ગઈકાલે રાત્રે થયું. કેટલીકવાર તમે તમારું 1૦૦ ટકા આપો છો, પરંતુ તે પૂરતું નથી. અમે અમારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં પરંતુ અદભૂત



રાજસ્થાન કોંગ્રેસનું ચાર લાખ સરકારી નોકરી આપવાનું વચન

1 જયપુર, તા. ૨૧ । કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે આ મેનિફેસ્ટો પાર્ટી કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવ્યો હતો જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જયપુરના પાર્ટી કાર્યાલયમાંથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં ૪ લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે જ્યારે ખેડૂતોને ૨ લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનો માટે 1૦ લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂક કરવામાં આવશે. યુવાનો માટે 1૦ લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂક કરવામાં આવશે. ● યુવાનો માટે 1૦ લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. ● ૪ લાખ નવી સરકારી નોકરીઓ આપવામાં આવશે. ● મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ● પરિવહનમાં જારી કરાયેલ મુસાફરી ભાડા પર ડિસ્કાઉન્ટ ઉપરાંત, મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે. ● મહિલાઓની સુરક્ષા માટે ગાર્ડની નિમણૂક કરવામાં આવશે. ● ખેડૂતો માટે એમએસપીમાટે કાયદો બનાવવામાં આવશે. ● ૨ લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. ● મનરેગા હેઠળ કામદારો માટે રોજગારનો સમયગાળો વધારીને 1૫૦ દિવસ કરવામાં આવશે. ● ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારનો સમયગાળો વધારીને 1૫૦ દિવસ કરવામાં આવશે. ● ઓટો અને ટેક્સી ડ્રાઈવરોનો ગિગ વર્કસ એક્ટમાં સમાવેશ કરવામાં આવશે. ● મેડિકલ સેક્ટરમાં ચિરંજીવી હેલ્થ પ્રોટેક્શન ઈન્સ્યોરન્સની રકમ ૨૫ લાખ રૂપિયાથી વધારીને ૫૦ લાખ રૂપિયા કરવામાં આવશે. ● ચિરંજીવીને નિઃસંતાન યુગલો માટેના આર્ટીફિશિયલ ઇન્ફેક્શનલ પેકેજમાં સામેલ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી સીએમ ગેહલોતે ચૂંટણી મેનિફેસ્ટો અંગે કહ્યું કે મિશન ૨૦૩૦ માટે અમે જે સર્વે કર્યો હતો તેમાં કરોડોથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો, અમે તેમના મંતવ્યોને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો બનાવ્યો છે. અમારા વિચાર એવા છે કે વચનો ન આપો અને જો વચનો આપો તો તેને પાળજો. તેમણે વધુમાં કહ્યું કે આજે સમગ્ર દેશમાં રાજસ્થાનની ચર્ચા થઈ રહી છે, આપણા કાયદાઓ અને આપણી ગેરંટી યોજનાઓ છે. જેઓ પેપર વીકનો મુદ્દો બનાવી રહ્યા છે તેમને પૂછો કે શું તેઓએ હજુ સુધી કોઈપણ રાજ્યમાં કોઈની ધરપકડ કરી છે અને કાયદો બનાવ્યો છે?

મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણનાં મોત રામલલા શહેરમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા અયોધ્યાની 1૪ કોસી પરિક્રમામાં શ્રદ્ધાનું પૂર ઉમટ્યું

1 મધુપુર, તા. ૨૧ । બિહારમાં મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણ લોકોનું મોત થયું હતું. જ્યારે ૨ લોકો ગંભીરપણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે ડીએમની ગાડી મધુપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ગાડી અનિયંત્રિત થઈ અને રોડ કિનારે કામ કરી રહેલા મજૂરોને કચડી નાખ્યા હતા. આ દરમિયાન એક મજૂર, મહિલા અને તેની ૭ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે લગભગ ૮ વાગ્યે બની હતી. અકસ્માત બાદ તરત જ ડીએમ અને તેમનો સ્ટાફ બાઈક પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ગાડીએ પહેલા મહિલા અને બાળકીને ટક્કર મારી તે પછી રોડ પર કામ કરી રહેલા મજૂરને કચડી નાખ્યો હતો. આ મજૂરો રાજસ્થાનના રહેવાસી હતા. બંને ઘાયલોને સારવાર માટે દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું. આ અકસ્માતમાં કુલ ૩ લોકોના મોત થયા છે. 1 અયોધ્યા, તા. ૨૧ । રાજા રામની નગરીમાં 1૪ કોસી પરિક્રમાની શરૂઆત બપોરે ૨:૦૮ વાગ્યે જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ભક્તોએ પરિક્રમાના પ્રારંભિક ભિંદુ, નાકા મુઝફ્ફર ખાતે સ્થિત હનુમાનગઢી મંદિરની માટી તેમના કપાળ પર લગાવીને પરિક્રમાના પ્રારંભ કર્યો હતો. માથે આસ્થાના પોટલા લઈને ઉઘાડપગું ભક્તોનું પૂર પરિક્રમા રૂટ પર જોવા મળ્યું હતું. લાખોની ભીડનો અંદાજ હતો અને મેળાની સુરક્ષા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક રહ્યું હતું. પરિક્રમા રૂટ પર રોડ કેમેરાથી નજર રાખવામાં આવશે. મહત્વપૂર્ણ સ્થળોએ દરેક વ્યક્તિ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહી હતી. ડીએમ નીતિશ કુમારના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે પરિક્રમા કરશે, તેથી પરિક્રમા રૂટ પર વિવિધ સ્થળોએ રેતી ઉમેરીને તેને આરામદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોમવારનો દિવસ નજીક આવતા જ હરિભક્તોનો આનંદ છલકાવા લાગ્યો હતો. કેટલાક લોકો પહેલાથી જ ગુમાઘાટ, હશ્મણઘાટ, સંત તુલસીદાસઘાટ, સૂર્યકુંડ, ગિરિજાકુંડ, રામનગરીની પરિઘ પર આવેલા નાકા હનુમાનગઢી જેવા



વર્લ્ડકપમાં પાકિસ્તાનના શરમજનક પરાજય બાદ ટીમમાં ફેરફાર પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ, સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવ્યો



1 કરાંચી, તા. ૨૧ । પાકિસ્તાન ટીમના વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પદથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફારો કર્યા છે. પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ બનાવ્યો છે. જયારે સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૯માંથી ૫ મેચ હારી હતી. પાકિસ્તાન પહોંચતાની સાથે જ બાબર આઝમે ટીમના કેપ્ટન પદથી રાજીનામું આપી દીધું હતું. તે પછી મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝને ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો. વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩માં નિષ્ફળતા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો, ટીર૦આઈકેપ્ટન - શાહીનઆફ્રીદી, ટેસ્ટ કેપ્ટન - શાન મસૂદ, કોચ - મોહમ્મદ હફીઝ, ડાયરેક્ટર - મોહમ્મદ હફીઝ, ચીફ સિલેક્ટર - વહાબ રિયાઝ, ફાસ્ટ બોલિંગ કોચ - ઉમર ગુલ, સ્પિન બોલિંગ કોચ - સઈદ અજમલ.



તંત્રી લેખ... શિક્ષણમાં સ્વચ્છતા જરૂરી

ક્રિકેટને આપણે ત્યાં દેશપ્રેમ સાથે જોડી દેવાય છે, અને પછી એની હાર થી સર્વત્ર નિરાશા છવાય છે



હે ઈશ્વર.

છેલ્લા ઇમ્પ્રોવમેન્ટ સોશલ મીડિયા પર વર્લ્ડ કપની હાર ને લઈને બહુ બધા મેસેજ ફોરવર્ડ થયાં! ઘણા મેસેજ રમત છે હવે, ચાલે હવે! તો ક્યાંક દશેરા એ જ ઘોડું ન દોડ્યું! એવી કોમેન્ટ પણ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ ખેલાડીઓ ને મળી, એકધારી દસ જીવનની વ્યક્ત કરી અને હાર માટે હોતાં હાં! એમ કહી હાર ને હળવી કરવા કોશિશ કરી. દેશ આખો આ હાર ને કારણે નિરાશ થયો! પણ મૂળ વાત એ છે કે રમતનું મહત્વ હોય પણ આટલું ભૂખું? અને એમાં પણ ક્રિકેટ ને આપણે ત્યાં દેશપ્રેમ સાથે જોડી દેવાય છે, અને એની હાર જીતને આટલું બંધુ મહત્વ આપી લોકો નિરાશ પણ થાય છે! આટલાં વસવસો તો આપણે સરહદે શહીદ થનારા માટે પણ કરતાં નથી! તો આજે બુધવારે બોધકથા એટલે આવો જ એક કિસ્સો કે જે આજની જનરેશન ને સજવાવવો બહુ જ જરૂરી છે. શહેરનાં નામાંકિત મનોચિકિત્સક લીલાવતી વોરા પાસે એક વખતનો ડોનર ક્રિકેટર પુષ્કર નાથ અને એના માતાપિતા બેઠાં હતાં, અને પોતાનો એકનોએક પુત્ર ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો છે, એની વાત કરી. એની માતા પલ્લવી ડોક્ટર ને પોતાના પુત્રની આ આદત છોડાવી મોત માંથી ઉગારી લેવાં માટે વિનવી રહી હતી.

વિભાવરી ડોક્ટર હોવાની સાથે સાથે એક મા પણ હતી.એટલે એ તે સ્ત્રીનું દર્દ સમજતી હતી. એ મનોમન વિચારતાં હતાં કે, અત્યારની જનરેશન ગોલ એવો સીલેક્ટ કરે, અને એને પણ કાયમ બધાની નજરમાં હોવું જ રહેવું હોય! અને આ ફીલ્ડમાં તો નવા નવા ચહેરા આવતા જાય, એટલે સ્વાભાવિક જૂનાંનું મુલ્ય ઘટવાનું જ છે! પણ નહીં એને તો આઈ એમ ધ વીનર! ની તકિત ઉતરવી ન જોઈએ, એ કેમ ચાલે! એણે એમની આખી વાત શાંતિથી સાંભળી લીધી, અને પછી એક જોરદાર લેક્ચર આડી દીધું. દરેક માતા પિતાએ પોતાના બાળકને નિષ્ફળતામાં



જ સફળતા છુપાયેલી છે એ શીખવવું જોઈએ. નિષ્ફળતાને સ્વીકારતા અને સફળતા ને પચાવતા શીખવવી જોઈએ. પરંતુ આજકાલ ઊંધું થઈ રહ્યું છે ઊલટાના માતાપિતા બાળક દર વખતે સફળ થાય એવું ઈચ્છતા હોય છે, અને બાળકના મન મગજ પર એ વાતનું ખૂબ જ પ્રેશર રહે છે. એમાં પાછું આ સતત સ્પર્ધાત્મક શિક્ષણ! જેમાં દરેક પરીક્ષાઓમાં ટોપ પર રહેવું પડે. એટલે જ નાની ઉંમરમાં બાળકો માનસિક રોગના શિકાર થતા જાય છે, નાની ઉંમરમાં જ વ્યસનોનો સહારો લેતા થઈ ગયાં છે, અને નાની એવી વાતમાં પણ જો નિષ્ફળ થશે એવું લાગે કે પછી નિષ્ફળ થાય તો સીધું સ્યુસાઈડ! હજી તો જીંદગીની ઉંચ નીચ જોઈ પણ ન હોય ત્યાં તો જીવન જ પુરું કરી નાખે! આમાં આપણે કોને દોષ દેવો મુદ વિદ્યાર્થીને કે માતા પિતા ને કે પછી શિક્ષણ પદ્ધતિ ને! એક બીજું ભૂત પણ આજકાલની પેઢી પર ચરેવું છે. જે સેલીબ્રીટી જેવા દેખાવું અથવા તો સેલીબ્રીટી બનવું. દરેકના પોત પોતાના રોલ મોડેલ હોય, કોઈ ચિરિત્રવાન ને આદર્શ માને તો હજી સમજાય, પણ મોટેભાગે ગલેમરની દુનિયાનાં અને સ્પોર્ટ્સ મેન ને આદર્શ માને! જેના પોતાના જીવનમાં જમીર જેવું ન હોય, એને આદર્શ બનાવવાથી ગેર માર્ગે દોરાવાના ચાન્સ વધી જાય છે. બોલીવુડ સેલીબ્રીટીની વાત શું કરવી! કરોડો લોકો જેને આદર્શ માનતાં હોય, એવાં કેટલાંય તો પાછલે બારણે દેશ દ્રોહી હોવાનાં જ્યારે સખત મળે, ત્યારે ધરતી પગ નીચેથી ખસી જાય! એવું જ સ્પોર્ટ્સ મેનનું છે ખરીદ વહેંચ ત્યાં

ગયો, ન મળે ત્યારે શરીરની નસો ફૂલવા લાગે! અને ડ્રેપેશન હાવી થતા ઊભો ઊભો સો દોઢસો રન કરવાં વાળો પુષ્કર નાથ લગભગ હવે દર વખતે શૂન્યમાં આઉટ થવા લાગ્યો, અને અંતે જેની ભીત હતી એ જ થયું, એટલે કે ટીમ માથી પડતો મુકાવો! આઈ એમ ધ વીનર માંથી, આઈ એમ ધ લુડર નું મહેણું એને આકરું લાગતું હતું, અને આ ગમ ભૂલાવવાં એ ડ્રગ્સ એડિક્ટ બની ગયો.

ડોક્ટર લીલાવતી વોરા એક કાબેલ અને અનુભવી ડોક્ટર હતાં, એણે ત્રણ ચાર કાઉન્સેલીંગ કરી, એનાં મનમાં હતું એ બધું જ કઢાવી નાખ્યું, અને પછી મેડિટેશન અને યોગના પ્રયોગો પણ કર્યાં. આ બધાં વાતાવરણથી દૂર હિલ સ્ટેશન પર પોતાના કેન્ડનાં મેડિટેશન સેન્ટરમાં મોકલ્યો. ત્રણ મહિના પછી એનામાં ઘણું સુધારો થયો, અને એનો વાંચન, સંગીત, ચિત્ર વગેરેમાં રસ કેળવ્યો. ડોક્ટર લીલાવતી વોરાનાં કહેવાથી એણે ડાયરી લખવાનું પણ શરૂ કર્યું હતું, એમણે કહ્યું હતું કે જે સારાં મારાબ અનુભવ થાય, એ બધાં ડાયરીમાં લખી નાખવાથી નકારાત્મકતા હટતી સુધી જતી નથી.

આમ સમયસર એને ટ્રીટમેન્ટ મળી જવાથી એ મોતના મુખમાંથી પાછો આવ્યો, નહીં તો એ એટલી હદે ડ્રેપેશન હતો કે એણે આત્મ હત્યા કરી લીધી હોત! એના માતાપિતા તો જેને હોય તેને કહે છે, ભલું થજો ડોક્ટર લીલાવતી બેનનું કે એણે અમારા દીકરાને ફરી પાછો હસતો રમતો કરી દીધો. અત્યારે તો એ એક સારો લેખક છે, ચિત્રકાર છે, ગાયક પણ છે, અને સૌથી મહત્વનું તેનું ફીલ્ડ એને પાછું મળ્યું, એટલે કે તે પોતાના શહેરની રણજી ટ્રોફી ટીમનો કોચ પણ છે. તો ડોક્ટર લીલાવતી વોરાની એક શીખ દરેક માતા પિતા એ પોતાના સંતાનોને આપવી રહી કે, સફળતાં નિષ્ફળતા તો જીવનનું એક ચેરર છે, એ કંઈ કાયમી રહેતી નથી, માટે નિષ્ફળતા ને સ્વીકારતા શીખવું જોઈએ એ જ રીતે સફળતા ને પચાવતા શીખવું જોઈએ. જો ન શીખ્યાં તો પછી આઈ એમ ધ વીનર આઈ એમ ધ લુડર માં ફેરવાઈ જાય, એ કંઈ કહેવાય નહીં! અને ઉપરથી જમીર વેચીને ષડયંત્ર રચ્યા હોય, એનો ભાર પણ મન પર રહે. સફળતા નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છે, બંને સાથે જ આવે પણ દેખાય એક એ યાદ રાખવું.

વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે એ ઠીક છે, યુવાનીમાં પણ ભક્તિનો રંગ લાવવો જ જોઈએ



દુર્વાસાને કોઈપણ પ્રકારની વાસના નથી. ખાનાર નારાયણ છે અને ખવડાવનાર નારાયણ છે. દુર્વાસાના આ ભ્રમ ઉપવાસ છે. જમાડનાર ભ્રમ અને જમનાર પણ ભ્રમ છે. એટલે દુર્વાસા કહે છે કે, હું ઉપવાસી છું અને તે સત્ય છે. બાહ્ય નજરે દેખાય છે તેના કરતાં અતિદેશી જેવું જ દેખે છે. શ્રીકૃષ્ણને કે દુર્વાસાને તે વસ્તુમાં આસક્તિ ન હતી, વાસના ન હતી. તેઓ ભોગો ભોગવ્યા છતાં નિષ્કામ હતા. ગુ હસ્થાશ્રમ અને સંચાસાશ્રમનો સમન્વય શ્રીકૃષ્ણે કરી બતાવ્યો છે. શ્રીકૃષ્ણ નિષ્કામ છે. નિષ્કામ શ્રીકૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ બને છે. ચીરહરણ લીલામાં રૂપિરૂપા ગોપીઓ છે. પાંચ-છ વર્ષની કન્યાને કુમારી કહે છે.

આ કુમારિકાઓની ઈચ્છા છે કે, શ્રીકૃષ્ણ અમારા પતિ થાય. ભાષા લોકિક છે પણ આમાં સિદ્ધાંત અલોકિક છે. જીવ ચાહે છે કે ઈશ્વર મારા પતિ થાય. શ્રીકૃષ્ણે સખીઓને કહ્યું હતું, યોગ્ય સમયે હું તમને મળીશ. આમાં ધ્યાન રાખવાનું કે ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી. પંચમહાભૂતના શરીરને પરમાત્મા સ્પર્શ પણ કરતા નથી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે, પંચભૂતનું શરીર છોડ્યા પછી આ લીલા થઈ છે. શ્રીકૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ પતિવ્રતા સ્ત્રીને બાળે છે તેમ પરમાત્માનો વિરહ આ જીવને બાળે છે. ગોપીઓનું પંચભૂતનું શરીર શ્રીકૃષ્ણવિરહમાં અગ્નિમાં બળી ગયું છે અને શ્રીકૃષ્ણના જેવું અપ્રાકૃત રસાત્મક શરીર તેઓને પ્રાપ્ત થયું છે. પંચભૂતિક શરીર સાથે પરમાત્માનું મિલન થઈ શકે નહીં. શ્રી કૃષ્ણનાં માત્ર દર્શનથી ગોપીને હવે તૃપ્તિ નથી. દર્શનમાં દ્વેષ છે. ગોપીઓને પરમાત્મા સાથે હવે એક થવું છે. એટલે પરમાત્માનો વિરહ એમને બાળે છે. કન્યાની લીલાનો પાર નથી. ગોવર્ધન લીલા માં શ્રીકૃષ્ણનાં દર્શન થયાં ત્યારથી ગોપીઓમાં મનું બીજા રોષણ થયું હતું અને પછી કન્યા ની પાંચળી સાંભળે છે. પ્રેમનો પ્રારંભ દ્વેષથી થાય કું. પ્રેયસી અને પ્રિયતમ જુદાં હોય છે, પણ અદ્વેત આવે છે, પ્રેમ દહાડે દહાડે વધે છે, ત્યારે પ્રિયતમ સાથે એક થવાની ઈચ્છા થાય છે. એટલે કે અદ્વેતની ઈચ્છા થાય છે. હું મટીને થું થવું એ પ્રેમ.




ગોપી વ્યાકુળ થાય એટલે કન્યા ત્યાં ઘરમાં પ્રગટ થાય છે. જીવ અતિ આતુર થાય ત્યારે ઈશ્વર મળે છે. ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે. મારે શ્રીકૃષ્ણને મળવું છે. મારે શ્રીકૃષ્ણ સાથે એક થવું છે. હવે એક ક્ષણ વિરહ ખમાતો નથી. શ્રીકૃષ્ણવિરહમાં ગોપીઓને હવે મૂર્છા આવે છે. હવે કોઈ વાસના રહી નથી. જીવ અતિશય શુદ્ધ થયો છે. ત્યારપછી રાસલીલા થાય છે. પોતાના બાળમિત્રોને શ્રીકૃષ્ણે તો કહી રાખ્યું હતું કે, કોઈને મૂર્છા આવે તો મને બોલાવજો. આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કન્યાને બોલાવવામાં આવે છે.

ગોપીઓની વાત એક વૃદ્ધ ગોપીને સમજાતી નથી. તે બેઠી બેઠી વિચાર કરે છે કે, કાંઈક ગરબડ જેવું છે. આ છોકરીઓને મૂર્છા આવે છે અને કન્યાઓ કાનમાં કાંઈક મંત્ર આપે છે. માટે કપટ કરીને પણ મારે આ મંત્ર જાણવો. ઘરડા માણસોને તેણે કહી રાખ્યું કે, મને મૂર્છા આવે ત્યારે કન્યાને બોલાવજો ડોસીએ નખરો કર્યો. ઘરનું કામ કરતાં ઢોંગ કરીને પડી ગઈ. વહુ શ્રીકૃષ્ણ પાસે જરાઈ. કન્યાએ તેને કહે છે, જેના વાળ ધોળા થયા હોય તેના ઉપર મારો મંત્ર કામ કરતો નથી. બીજાને ઘેલાવો! હું નહીં આવું. પણ ગોપી કહે, કન્યા તારે આવવું જ પડશે. છેવટે કન્યાઓ આવ્યો. ડોસીને) બે જાન વળગ્યું છે. લાકડી લઈ આવો! કન્યાએ લાકડી વતી એક-બે જોરથી માર્યાં. ડોસીથી સહન ન થયું અને બોલી પડી, મારો નહીં. મને મૂર્છા આવી નથી. હું તો ઢોંગ કરું છું. કન્યાઓ કહે, ભૂત એમ જ બોલે. ડોસીને સારી પેઠે માર પડ્યો. વેષ વૈષ્ણવો અને અંદર કામક્રોધ સંઘર્ષો હોય તો માર ખાવો જ પડે! ભક્ત હોવાનો ડોંગ એ ભૂત છે. ઢોંગ એ ભૂત છે. અભિમાન એ ભૂત છે. માટે દંભ ન કરો.

ભક્તિ બીજાને બતાવવા માટે નથી. ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તિ અને જ્ઞાનનો જેટલો દેખાવ કરે છે તેટલા અંદરથી રંગાયેલા હોતા નથી. ઘણા બહારથી દેખાવ કરે છે કે, હું મોટો ભક્ત છું, પણ અંદરથી કેટલું પ્રભુનું અનુસંધાન છે તે તો એ જાણે! પણ શ્રીકૃષ્ણ અંતર્યામી છે. અંતર્યામીને કોઈ છતરી શકે નહીં. રાસલીલામાં ત્રણ સિદ્ધાંત યાદ રાખો: રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી. આમાં લોકિક કામ નથી. આ સ્ત્રી-પુરુષનું મિલન નથી. આ જીવ-ઈશ્વરનું મિલન છે. શુદ્ધ જીવનો ભ્રમ સાથે વિલાસ તે જ રાસ. શુદ્ધ જીવ એટલે માયાના આધારપરહિત જીવ. આ જીવ અને ભ્રમનું મિલન છે. શુદ્ધજીવને કહ્યું છે કે, આ લીલા નું અનુકરણ કરશો નહીં. આ લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. પતિના વિયોગમાં પત્નીના પ્રાણ ઝૂરે છે તે પ્રમાણે ઈશ્વરના વિયોગ માં જીવના પ્રાણ કેવી રીતે ઝૂરે છે એ બતાવવાનો રાસલીલા નો હેતુ છે. કાકોરજીના વિરહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી, તેને ભગવાન મળતા નથી. આ આતુરતા બતાવવા સ્ત્રી-પુરુષ નાં દેહાંતનો આશરો લીધો છે. શુંગાર રસનો આશરો લીધો છે. રાસમાં આત્મા-પરમાત્માનું નિર્વિકાર મિલન છે. ભગવાને ગોપીઓને કહ્યું હતું કે, શરદ ઋતુની રાત્રે હું તમને બોલાવીશ. તે શરદ ઋતુની રાત્રિ આવી પહોંચી.

રાસલીલાને બરાબર સમજવાની જરૂર છે. રાસલીલા એ કામલીલા ની કથા નથી. રાસલીલા એ તો કામવિજયની લીલા છે. રાસલીલામાં કામની ગંધ સરખી પણ નથી. શ્રીકૃષ્ણ પાસે કામ જઈ જ ન શકે. શ્રીકૃષ્ણ કામથી પર છે. આ ક્રિયા ભલે લોકિક લાગે, પણ આમાં કામવિકાર નથી એટલે રાસ લીલાને કામવિજય લીલા કહી છે.

શાકભાજીની વધતી માંગ ખેડૂતો માટે ઉત્સાહપ્રેરક
સંયુક્ત રાષ્ટ્ર એ વર્ષ 2023ને 'ઇન્ટરનેશનલ યર ઓફ સંમિલિટ' તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં વવાતાં ધાનના પાકોમાં નાગલી- રાગી મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાઉ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત અને આખા ભારતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદનક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં કુલ ૧૪,૧૬૧ હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થાય છે. તેમાંથી ૧૮,૯૦૫ મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થાય છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર ધાન્ય પાક છે. તેના દાણામાં રેસાની માત્રા વધારે, સારી ગુણવત્તાવાળું મોટીન, ખનીજ તત્ત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે તે ખૂબ લાભદાયકી છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં વધારે હોવાથી તેનો ઉપયોગ દુધાપેશ દૂર કરવામાં થાય છે. હાલનાં સંજોગોમાં લોકોની આરોગ્ય અંગેની સજાગતાને કારણે પોષક તત્વોથી ભરપૂર નાગલીનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. પરંતુ, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ડાંગ જિલ્લા સિવાય ડાંગર, કપાસ જેવા પાકના વ્યાપ વચ્ચે નાગલી જેવા પૌષ્ટિક ધાન્યનો પાક બહુ ઓછો જોવા મળે છે. કપાસની ખેતી કરતાં ખેડૂતો પણ ખાસ ખુશ નથી. ગયા વર્ષે કપાસના ખેડૂતોને ૨,૭૦૦ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, પરંતુ મે-૨૦૨૩માં ભાવ ૧,૫૦૦ રૂપિયાની નીચે પહોંચી ગયો. ખેડૂતોને આ વખતે ૨,૦૦૦ રૂપિયા પ્રતિ મણ જેટલો ભાવ મળવાની આશા હતી, પરંતુ હવે બીક છે કે જવદી માલ નહીં વેચાય તો તેને એક હજાર રૂપિયાના ભાવે પણ વેચવો પડયો છે. કપાસના પાકના ઘટલા ભાવ અંગે રૂ બજારો સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે આ વખતે માગની સરખામણીએ પુરવઠો વધારે છે તેને કારણે કપાસના ભાવો નથી. જ્યારે ગત વર્ષે માગ વધુ હતી અને પુરવઠો ઓછો, એ સ્થિતિમાં કારણે રૂના બજારમાં તેજ હતી. આમ કોઈપણ પાક માટે ખેડૂત ખાસ ખુશ જણાતો નથી. ખેતીની આવક વધારવા લોકપ્રિય પાક માટે ખેડૂત પ્રયત્ન કરે છે, જેમાં હવે આરોગ્ય અંગે આવેલ જાગૃતિ સાથે રાસાયણિક ખાતર ને બદલે ઇલાક્ષિયાં ખાતર અને અણસીયાં ખાતરથી ખેતી કરવા તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. રાસાયણિક ખાતર વગર ખેતી ન થઈ શકે એ વાત એક આખી પેઢીના સમયમાં કાયમી બની જતાં ખેડૂતો માટે મુશ્કેલીઓ નો એ જ સ્થિતિમાં રહી છે. જોકે, આજે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધવાથી અને વિવિધ પ્રકારના પાક મળવાની વાત ઘણાં ખેડૂત પરિવારો સ્વીકારી રહ્યા છે.



ચહેરા પરના ખીલ ૨ દિવસમાં છૂંતર થશે

સ્કિનની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો ફેસ ખરાબ લાગે છે. અનેક લોકોના ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. ખીલ તમારી પર્સનાલિટી અને ફેસને ખરાબ કરવાનું કામ કરે છે. ખીલ તમે દૂર કરતા નથી તો મેક અપ પણ પ્રોપર રીતે કરવામાં મુશ્કેલી થાય છે. આમ, અનેક લોકોને ખીલ ફોડવાની આદત હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમે ખીલ ફોડવાથી વધારે થાય છે અને સાથે તમારા ફેસ પર ડાઘ પણ પડી જાય છે. આ માટે ખીલને ક્યારેય પણ ફોડશો નહીં. એક્સપર્ટ અનુસાર ખીલ ફોડવાથી બીજા નવા વધારે થાય છે અને તમારો ફેસ ખરાબ લાગે છે. આમ, તમારા ફેસ પર ખીલ વધારે થાય છે તો આ પેસ્ટ અસરકારક છે. આ પેસ્ટ બનાવવા માટેની વસ્તુઓ તમને સરળતાથી રસોડામાં મળી રહેશે. આ આયુર્વેદિક પેસ્ટ હોવાથી સ્કિનને કોઈ નુકસાન થતુ નથી. આ પેસ્ટ બનાવવા સૌ પ્રથમ બે ચમચી એલોવેરા જેલ લો. આ એલોવેરા જેમાં ચપટી હળદર નાખો. ત્યારબાદ એક ચમચી ચંદનનો પાવડર અને એક ચમચી તજનો પાવડર લો. આ બધી વસ્તુઓને પ્રોપર રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને ૫ મિનિટ માટે રહેવા દો. આ પેસ્ટ ફેસ પર લગાવતા પહેલાં ચહેરાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ આ પેસ્ટને ફેસ પર લગાવો. હવે અડધો કલાક માટે રહેવા દો અને પછી પાણીથી ફેસ ધોઈ લો. ત્યારબાદ મુલતાની માટીનો ફેસ પેક લગાવો. આ પેસ્ટ ફેસ પર જ્યારે સુકાઈ જાય ત્યારે પાણીથી ફરી માં ધોઈ લો. આ પેસ્ટ તમે દરરોજ ફેસ પર લગાવી શકો છો. આ પેસ્ટથી ખીલ દૂર થઈ જશે અને ચહેરા પરના કાળા ડાઘ પણ દૂર થઈ જશે. તમારા ફેસ પર કાળા ડાઘ બહુ છે તો આ પેસ્ટ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેસ્ટથી સ્કિન પર મસ્ત ગ્લો પણ આવે છે.

મેલ જામવાથી ગરદન ખરાબ દેખાય છે? નાળિયેરના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો ફ્લીન થઈ જશે ગરદન

તમે પણ ગરદન પર જામેલા મેલથી પરેશાન છો કે પછી તડકાના કારણે ગરદન પર ટેનિંગથી ગઈ હોય તો અહીં જાણો કઈ રીતે ડાર્ક ગરદનને કેવી રીતે સાફ કરી શકાય છે. સામાન્ય રીતે આપણે ચહેરાની સુંદરતાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ પરંતુ ગરદનને ભૂલી જઈએ છીએ. કોઈના ચહેરા પર જેટલું જલદી ધ્યાન જાય છે, એટલી જલદી નજર ગરદન તરફ પણ જાય છે. ગરદન કાળી થવી અથવા ગરદન પર ગંદકી જમા થવાના ઘણા કારણો છે. ગરદનને યોગ્ય રીતે સાફ ન કરવી, વાળ હંમેશા ખુલ્લા રાખવા, ગરદન પર હાઈપરપીગમેન્ટેશન, ગરદન પર ટેનિંગ (ટ્રહલેહલ્મ) અથવા હોર્મોનલ કંડીશનથી પણ ગરદન કાળી (ફ્લેકી દીથા) દેખાય છે. અહીં કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો આપવામાં આવી રહ્યા છે જેની મદદથી ગરદનની ડાર્કનેસ હળવી કરી શકાય છે. બટાકાના રસની કાળી ગરદન પર કમાલ અસર થાય છે. તમે બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાવી શકો છો અથવા તમે માત્ર બટેટાનો રસ લગાવી શકો છો. તેને કોટન વડે ગરદન પર લગાવો અને થોડી વાર પછી ધોઈ લો. અઠવાડિયામાં ૩ થી ૪ વાર તેનો ઉપયોગ કરવાથી ગરદન સાફ થવા લાગે છે. કાળી ગરદન સાફ કરવા માટે પેસ્ટ બનાવીને પણ લગાવી શકાય છે. આ પેસ્ટ બનાવવા માટે ચણાના લોટમાં અડધી ચમચી લીંબુનો રસ, એક ચપટી હળદર અને દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ગરદન પર ૧૫ મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવવાથી ગરદન સાફ થવા લાગશે. બેકિંગ સોડા ડાર્ક નેક પર પણ સારી અસર દર્શાવે છે.



બેકિંગ સોડામાં એક ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ગરદન પર લગાવો અને ૧૦ મિનિટ સુધી રાખો. આ પછી, ગરદનને ભીના કપડાથી સાફ કરો. બેકિંગ સોડા ગરદન પરથી ગંદકી અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. ટામેટાના ઉપયોગથી પણ ગરદન પર રનો ડાર્કનેસ દૂર કરી શકાય છે. કારણ કે તેમાં સ્કિન લાઈટનિંગ પ્રોપર્ટીઝ જોવા મળે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી ઓટમીલ, ચારથી પાંચ ચમચી દૂધ અને એક ઈણેલું ટામેટા લો. બધું સારી રીતે મિક્સ કરો અને તેને ગરદન પર લગાવો. પછી તેને સૂકવવા માટે છોડી દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે ગરદનને સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ પેકનો ઉપયોગ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. મધ અને લીંબુની પેસ્ટ પણ કાળા ગરદનને સાફ કરવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે લીંબુના રસમાં મધ મિક્સ કરો અને આ પેસ્ટને ગરદન પર હળવા હાથે લગાવો. તેને ગરદન પર ઓછામાં ઓછા ૧૫ મિનિટ સુધી

રહેવા દો. આ પછી તેને પાણીથી ધોઈ લો. ડાર્ક નેક ટ્રીટમેન્ટ હળદર અને દૂધથી પણ કરવામાં આવે છે. આ પેક તૈયાર કરવા માટે, એક ચમચી ચણાના લોટમાં એક ચમચી દૂધ અને એક ચપટી હળદર મિક્સ કરો, આ પેકને ગરદન પર લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો. પછી ૧૫ મિનિટ પછી સ્ક્રબ કરીને ધોઈ લો. એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરવાથી તમારી ગરદન સાફ થઈ જશે. ગરદન પર જમા થયેલી ગંદકીને હળદર અને દહીંનું પેક લગાવવાથી પણ દૂર કરી શકાય છે. આ માટે એક ચમચી દહીં, બે ચપટી હળદર, બેથી ત્રણ લીંબુનો રસ, બેથી ચાર ચમચી દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ગરદન પર સારી રીતે લગાવો અને ૩૦ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ગરદનને પાણીથી ધોઈ લો. જો તમે અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરશો તો તમારી ગરદન સાફ થવા લાગશે. વાસ્તવમાં, જ્યારે આપણે ત્રિપુર પ્રકાશના સંપર્કમાં હોઈએ છીએ, ત્યારે ત્વચાની સપાટી પર હાજર મેલાનિન ત્વચાના ડીએનએને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે વધે છે, જેના કારણે ત્વચા કાળી અને કાળી થવા લાગે છે. આ ત્વચાની સંરક્ષણ પ્રક્રિયા છે. પરંતુ આ કાળાશ એટલે કે ટેનિંગ સારી નથી લાગતી અને અસમાન દેખાવા લાગે છે. તેનાથી બચવા માટે સનસ્ક્રીન લગાવવું ફાયદાકારક છે. પરંતુ કેટલીકવાર આ બધા હોવા છતાં, સન ટેનિંગ થાય છે. આવી સ્થિતિમાં, તેમને દૂર કરવું સરળ કાર્ય નથી. ખાસ કરીને ગરદન પર ટેનિંગ ખૂબ જ હડીલા અને કંદરૂપું લાગે છે. જો તમારી ત્વચા પર પણ ટેનિંગ આવી ગયું છે, તો તમે તેને મધની મદદથી દૂર કરી શકો છો.

શું તમારા પણ હાથ ક્યારેક ધૂંજે છે?



જો શરીરમાં કોઈ પોષક તત્ત્વો કે વિટામિનની ઉણપ હોય તો વિવિધ પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. એવું જ એક વિટામિન છે, જેની ઉણપથી હાથ ધૂંજવા લાગે છે. ત્યારે એવું ક્યું વિટામિન છે જેના કારણે આવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ નબળાઈ, ચક્કર આવવા લાગે, ત્વચા પીળી પડવા લાગે, જોવામાં તકલીફ થાય અને હાથ ધૂંજવા લાગે, તો સંભવ છે કે, તમારામાં આ એક વિટામિનની ઉણપ છે. અહીં જે વિટામિનની વાત કરવામાં આવી રહી છે તે શરીરની નર્વસ સિસ્ટમની યોગ્ય કામગીરી માટે જવાબદાર છે. આ વિટામિનનું નામ વિટામિન B12 છે. ઉપરોક્ત લક્ષણો ત્યારે જ દેખાવા લાગે છે જ્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય છે. ઘણા લોકોને હાથ ધૂંજારીની સમસ્યાને કારણે પરેશાન થવું પડે છે. આ વિટામિનની ઉણપને કારણે, હાથ અને પગમાં કળતરની લાગણી થાય છે અને વ્યક્તિને તેના રોજિંદા કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જાણો કેવી રીતે વિટામિન B12 ની ઉણપને પૂરી કરી શકાય છે અને ખોરાકમાં કયા ખોરાકનો સમાવેશ કરવો ફાયદાકારક છે. એવા ઘણા ખોરાક છે જે વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે, જે લોકો શાકાહારી અથવા વિગન છે તેઓએ વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ડાક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે વિટામિન B12 મોટાભાગે માંસાહારી ખોરાકમાં જોવા મળે છે. પ્રોટીનયુક્ત ઈંડા ખાવાથી શરીરને વિટામિન B12 પણ મળે છે. વિટામિન B12 મેળવવા માટે, તમે દરરોજ ૨ મોટા હાઈ બોઈલ્ડ ઈંડા ખાઈ શકો છો. જેમ જેમ તે બહાર આવ્યું છે, હાથ ફક્ત વૃદ્ધ લોકો અને દારૂના નશામાં જ નહીં, પણ નદન યુવાન લોકોમાં પણ ધુજતા હોય છે. સાચું, તમે એમ ન કહી શકો કે તેઓ સ્વચ્છ છે. ધુજારીની સુચિબદ્ધ જાતો પ્રમાણમાં દુર્લભ છે, તેની સરખામણીમાં. તે હાથના ધુજારીના તમામ કેસોમાં ૫૦% થી વધુ કબજે કરે છે. અને તેનું મુખ્ય લક્ષણ ચોક્કસપણે ધુજારી છે. ઘણીવાર ફક્ત એક જ હાથ હલાવે છે, દર્દી, સરળ રીતે, છલકાયા વિના તેના માંમાં ચમચી લાવી શકતો નથી, પોતાની સેવા કરી શકતો નથી. આ રોગ, ખાસ કરીને, નિવૃત્તિની ઉંમરની નજીકના લોકોને અસર કરે છે. આ રોગ ધીમે ધીમે વિકસે છે.

મોઢામાં ચાંદા પડી ગયાં હોય તો આ ઘરેલુ ઉપચારથી તરત જ રાહત મેળવો



ગરમીની સીઝન હોય કે ઠંડીની સીઝન, ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જાય છે. જેના કારણે તેઓ કંઈ ખાઈ કે પી નથી શકતાં. મોઢામાં કંઈક મૂકતાં જ ખૂબ જ પીડા થાય છે. તે સામાન્ય રીતે જીભ, પેઢા, હોઠ, મોઢાની અંદર કે ગળામાં થાય છે. સાંભળવામાં ભલે આ સમસ્યા સાધારણ લાગે પરંતુ તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તે મોટી સમસ્યા બની શકે છે. મોઢામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણીવાર શરીરમાં ગરમી વધવાના કારણે પણ મોઢામાં ચાંદા પડવા લાગે છે. પરંતુ વારંવાર મોઢામાં ચાંદા પડવા કોઈ મોટી સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે.

તો જો તમે પણ મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી પરેશાન હોવ અને ઘરેલુ ઉપાય શોધી રહ્યાં છો તો અહીં અમે તેમને કેટલાંક એવા ઉપાય જણાવીશું જેની મદદથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. મોઢાના ચાંદા દૂર કરવા માટે તમે બ્લેક ટીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે સીધો જ બ્લેક ટીથી શેક કરવામાં આવે તો તેનાથી મોઢાના ચાંદામાં રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે બ્લેક ટીમાં રહેલુ ટેનિન-સ હીલીંગ પ્રોપર્સેસને ઝડપી બનાવે છે. તેના માટે તમારે એક કપ ગરમ પાણીમાં ટી બેગ નાંખીને થોડી વાર રહેવા દેવાની છે. જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેનાથી ચાંદા પર શેક કરવાનો છે.

તેનાથી ચાંદામાં રાહત મળશે. દહીં એક પ્રોબાયોટિક છે જેને આંતરડા માટે સારુ માનવામાં આવે છે. પરંતુ જો તમે મોઢાના ચાંદા દૂર કરવા માંગો છો તો તમે દહીંનું સેવન કરી શકો છો. દહીંની તાસીર ઠંડી હોય છે જે ચાંદાની બળતરા ઓછી કરવામાં મદદરૂપ છે. નાળિયેર તેલ મોઢાના ચાંદાથી રાહત અપાવવામાં અસરકારક છે. તે સોજા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઈન્ફલેમેટરી કંપાઉન્ડ જોવા મળે છે. ચાંદા પડ્યા હોય તે વિસ્તારો પર નારિયેળ તેલ લગાવો. તમને થોડા કલાકોમાં રાહત મળી શકે છે. ચાંદા પર નારિયેળ તેલ લગાવીને આખી રાત રહેવાથી તે દૂર થઈ શકે છે.

BOLLYWOOD NEWS FLASH

વિજય દેવરકોંડાનો અવાજ સાંભળીને શરમથી લાલ થઈ રશ્મિકા મંદાના

ટાઈગર ૩ બાદ હવે ફેન્સ બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને રણબીર કપૂરની જોડી જોવા મળશે. ફિલ્મનું ટીકર લોકોને ખૂબ પસંદ આવ્યું છે. ફિલ્મના ગીતો પણ લોકપ્રિય છે. હવે આ ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં ૨૧મી નવેમ્બરે રિલીઝ થવાનું છે. આવી સ્થિતિમાં 'એનિમલ'નો ગુંજતો રહે છે. ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. ગઈકાલે બુર્જ ખલીફા પર ફિલ્મનું ટ્રેલર પણ બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો રશ્મિકા મંદાના અને રણબીર કપૂરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રશ્મિકા મંદાના અને રણબીર કપૂર 'એનિમલ'ના પ્રમોશન માટે તેલુગુ ચેટ શોમાં ગયા હતા. બંને અદ્ભુત દેખાતા હતા. રશ્મિકાએ કાળી સાડી પહેરી હતી. જ્યારે રણબીર કપૂરે ચેક શર્ટ પહેર્યો હતો. આ દરમિયાન સ્કીન પર બે ફિલ્મોના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. પહેલી ફિલ્મ 'અર્જુન રેડ્ડી' હતી, જ્યારે બીજી ફિલ્મ 'એનિમલ' હતી. આ જોઈને રણબીરે હોસ્ટને રશ્મિકાને પૂછવા કહ્યું કે કોણ વધુ સારી એક્ટર છે. આ સાંભળીને રશ્મિકા કંઈ બોલ્યા વગર હસવા લાગી અને તે શરમાઈ ગઈ.



ઐશ્વર્યા રાય ભચનની લાડલી આરાધ્યા ભચન સુપર ટેલેન્ટેડ છે




અશ-અભિની દીકરી આરાધ્યાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. આરાધ્યા એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે પોતાનું નામ કંઈક અલગ રીતે રોશન કરશે. સ્ટાર કિડ્સમાં હોશિયારના વિસ્તમાં આરાધ્યાનું નામ સૌથી પહેલાં આવી શકે છે. આરાધ્યા ભચન ઈન્ડસ્ટ્રીમાંથી સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. આજે આરાધ્યા ભચન ૧૨ વર્ષની થઈ ગઈ છે. ૧૨ વર્ષની આરાધ્યા પોતાના ટેલેન્ટથી હંમેશા લોકોને મુશ્કેલી કરી દેતી હોય છે. નાની ક્યૂટી આરાધ્યાના લુકસને સામાન્ય રીતે મોમ અેશ સાથે કમ્પેર કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આરાધ્યા માત્ર ખૂબસુરતીમાં જ નહીં, પરંતુ મોમ ઐશ્વર્યાની જેમ સુપર ટેલેન્ટેડ પણ છે? આરાધ્યા ભચન ડાન્સ, સિંગિંગમાં સૌથી આગળ છે. આરાધ્યાના કેટલાક ડાન્સિંગ અને સિંગિંગના વિડીયો પણ વાયરલ થતા હોય છે. સ્કૂલથી લઈને બીજા કોઈ પણ પ્રકારના ફંક્શનમાં આરાધ્યા પરફોર્મ કરતી હોય છે. આરાધ્યાના પરફોર્મથી લોકો મુશ્કેલી થઈ જાય છે અને ફેન્સ વખાણ કરવા લાગે છે. ઉલ્લેખનીય છે કે આરાધ્યા ભચનના એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી, જેમાં આરાધ્યા મોમ ઐશ્વર્યાની બંધ ૩ પર મસ્ત સ્પીચ આપતી જોવા મળી હતી. આ દરમિયાન આરાધ્યાના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. આ પહેલાં પણ આરાધ્યાએ અનેક સુપર પરફોર્મથી ફેન્સને મુશ્કેલી કરી દીધા હતા. આમ આરાધ્યાએ ૨૬ જાન્યુઆરીના રોજ સારે જહાં સે અચ્છા અને માં તુજે સલામ ગીત પર પણ મસ્ત પરફોર્મન્સ કર્યું હતું. નાની ઉંમરમાં આરાધ્યા એક સુપર ટેલેન્ટેડ ગર્લ છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. આરાધ્યા દર વર્ષે એના સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કરતી હોય છે.

ભારતની સેમિફાઇનલમાં જીત પછી અમિતાભ ભચનની પોસ્ટ પર યુઝર્સ થયા જોરદાર ગુસ્સે



ભારતીય લોકોને ક્રિકેટ પ્રત્યે અદ્ભૂત પ્રેમ છે. કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હતી જેમાં ભારતની હાર થઈ. આ કારણે કરોડો લોકો નિરાશ થઈ ગયા છે. ભારતની ટીમને સપોર્ટ કરનાર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલું જ નહીં બોલિવૂડ સેલેબ્સ પણ નારાજ થઈ ગયા હતા. જો કે આ વિશે બોલિવૂડના મહાનાયક અમિતાભ ભચનની એક પોસ્ટ તેજથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ જોયા પછી ફેન્સ અમિતાભ ભચન પર ગુસ્સે થઈ રહ્યા છે. કેટલાક લોકોએ અમિતાભ ભચનને ટ્રોલ પણ કરી રહ્યા છે. ભારતની હાર પછી થોડી વાર પહેલાં અમિતાભ ભચનને અજીબ પોસ્ટ કરી હતી. આ એક્સ પોસ્ટમાં અમિતાભે લખ્યું હતું કે... કુછ ભી તો નહીં...! આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ રહી છે. આ વિશે ફેન્સ એક્ટરને પૂછવા લાગ્યા કે શું એમને ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોઈ લીધી. એક ફેને કોમેન્ટમાં લખ્યું કે, સર પહેલાં તમે તમારું ટીવી બંધ કરી દો. તમને જણાવી દઈએ કે ભારતની સેમિફાઇનલમાં જીત પછી અમિતાભ ભચનની એક એક્સ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

રેખા બોઝે ભારતની વર્લ્ડ કપની હાર બાદ ઈમોશનલ પોસ્ટ મૂકી



ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ પહેલા તેલુગુ એક્ટ્રેસ રેખા બોઝે બિંદાસ નિવેદન આપ્યું હતું જેની ચારેતરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કંઈક આવું જ નિવેદન ૨૦૧૧ના વર્લ્ડ કપ સમયે એક્ટ્રેસ પૂનમ પાંડેએ આપ્યું હતું. તે સમયે તેણે ખૂબ ચર્ચા લૂટી હતી. પણ હવે આ બધી જાહેરાતો અવગી પડી છે અને ક્રિકેટ ફેન્સ માટે દુઃખની ઘડી આવી ગઈ છે. રેખા બોઝે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, જો ઈંડિયા વર્લ્ડ કપ જીતી જશે તો તે વિશાખાપટ્ટનમના દરિયા કિનારે કપડા પહેર્યા વિના દોડશે. આ રીતે તે જીત માટે ટીમ ઈંડિયાને શુભકામના આપશે. એક્ટ્રેસના વિવાદિત નિવેદન બાદ લોકોએ તેના પર પબ્લિસિટી સ્ટંટનો આરોપ લગાવ્યા હતા, અને તેને ટ્રોલ પણ કરી હતી. હવે અમદાવાદમાં વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ટીમ ઈંડિયાની હાર બાદ દેશના ૧૪૧ કરોડ દિલ તૂટી ચુક્યા છે. તેમાંથી એક નામ રેખા બોઝનું પણ છે. આ એજ એક્ટ્રેસ છે જેણે બે દિવસ પહેલા જ પ્રોતિમ્સ કર્યું હતું કે જો ટીમ ઈંડિયા જીતી તો તે બીચ પર પોતાના કપ ડા ઉતારશે. હવે તેલુગુ અભિનેત્રી રેખા બોઝે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાના પેજ પર લખ્યું છે, દિલ તૂટી ગયું છતાં મેરા ભારત મહાન.



ઝાલોદ તાલુકાના લીમડી નગરના સુધારવાસા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે વ્યક્તિ ઝડપાયા

। પંકજ પંડિત ઝાલોદ, તા.૨૧ ।
ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવતા સુધારવાસા ગામે થી પી.એસ. આઈ એમ.એફ.ડામોરને મળેલી બાતમીને આધારે અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી પદ ૧૬૪૦ નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડેલ હતા.



લીમડી પોલીસને મળેલ બાતમી મુજબ સુધારવાસા તરફથી લીમડેડા તરફ જતા મુવાળી ફળિયાના રોડ પર બોલેરો પીકઅપ ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ તેમજ ટીવીએસ જયુપીટર પાયલોટીંગ કરનાર વ્યક્તિ સાથે બે વ્યક્તિની અટકાયત કરેલ હતી તેમજ અન્ય છ વ્યક્તિઓ પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. કમલેશ ધીરજી પલાશ (બોરવાણી, દાહોદ) અને દુબા બાબુ

પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી ફર સેટ દ્વારા વીજળી પૂરી પડાશે ગિરનાર લીલી પરિક્રમાના રાત્રી મુકામના ૮ પડાવ ખાતે જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઉભી કરાઈ



। જૂનાગઢ, તા.૨૧ ।
ગિરનાર લીલી પરિક્રમા માટે ઉમટી પડતા ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગર પાલિકા અને વન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપ્યો છે. જેમાં પરિક્રમકર્તાઓ માટે લાઈટની સગવડના માટે તંત્ર દ્વારા પુષ્પા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમાના રોટ રાત્રે મુકામના ૮ પડાવ ખાતે જનરેટરના માધ્યમથી લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ મારફત વીજળી પૂરી પાડવામાં આવશે. પરિક્રમા રૂટના બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા માળવેલાની ઘોડી તરફ, જીણાબાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકી વાળો પોઈન્ટ-૧, મોળા પાણીના

પુલ (નાળુ) પાસે, ડેરવાડ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઈડ પગથીયા પુરા થાય પછી પગથિયા થી ૧ કિલોમીટર દૂર (પોઈન્ટ બલ જનરેટર-૧) DG સેટ મુકામમાં આવશે. મહાનગરપાલિકા ની હદમાં મનપતંત્ર દ્વારા લાઈટ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ભવનાથ પરિસરમાં વીજ સલામતી જળવાઈ રહે તે માટે પણ વીજતંત્ર જરૂરી ચકાસણી કરવામાં આવી છે. ઉપરાંત પરિક્રમા ના રૂટ અને ભવનાથ પરિસરમાં વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે તે માટે PGVCL ની ટીમોને ફરજ સોંપવામાં આવી છે. કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તંત્ર દ્વારા પરિક્રમકર્તાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ખેડા જિલ્લાની કુલ ૩૨ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦% કામગીરી પુર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ : ખેડા જિલ્લાના નાગરીકોનું ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર

। ખેડા, તા.૨૧ ।
ઘર વિહોણા નાગરીકોને ઘર આપવા માટેની સરકારની ફલેગશીપ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જિલ્લાની કુલ ૩૨ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦ % કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં ગળતેશ્વર, કપડવંજ, ખેડા, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા અને વસોની કુલ ૩૨ પંચાયતોમાં કુલ ૨૧૮ ટાર્ગેટ બ્લોકમાં ત્રણ તબક્કામાં કુલ ૨૧૮ આવાસો બાંધવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગળતેશ્વર તાલુકાની મીઠાના મુવાડા પંચાયતમાં ૦૫; કપડવંજના ભોજાના મુવાડા, કાભાઈના મુવાડા, રોઝાવાડા અને શીહોડા પંચાયતોમાં કુલ ૨૪; ખેડાના હરીયાળા, કાજુપુરા-વૈકુંઠપુરા, કલોલી,

મહિજ, નવાગામ, રહુ, રસીકપુરા, સખેજ, સામદ્રા, સરસા, વારસગ અને વાસણાબુજર્ગ પંચાયતમાં કુલ ૭૬; મહુધાની હજાતીયા, મોટી બડોલ અને મુલજ પંચાયતોમાં કુલ ૦૮; માતરની ચાનોર અને કઠોડા પંચાયતમાં કુલ ૦૪; મહેમદાવાદની ઈયાવા અને સાદરા પંચાયતમાં કુલ ૧૨; ઠાસરામાં બાધરપુરા, સૈયત અને વામળીમાં કુલ ૬૮ તથા વસો તાલુકાના બામરોલી, ગંગાપુરા, મિતાલ, પલાણા અને રુણમાં કુલ ૨૧ આવાસો, એમ કુલ ૨૧૮ આવાસોનો લાભ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લામાં યોજનાર વિકસિત ભારત સંકલ્પત્તા દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર ૩૨ પંચાયતોના સરપંચોનું સન્માન કરવામાં આવશે.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ,લ,ઇ) :
આજના દિવસે થોડી મોજ-મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. તમારી જાતને મોટા શુભ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ.

સિંહ (મ,ટ) :
આજના દિવસે ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો? તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો.

ધન (ભ,ધ,ફ) :
આજના દિવસે ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. કાર્યક્ષેત્ર માં કોઈ મુશ્કેલી હોવા ને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો.

વૃષભ (બ,વ,ઉ) :
આજના દિવસે મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવાડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીર્વાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખલેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો.

કન્યા (પ,ઠ,ણ) :
આજના દિવસે તમારા પ્રયંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. ધન ની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસા ની બચત કરવાનું વિચાર બનાવો? છેલ્લા થોડા સમયથી તમારું અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

મકર (મ,જ) :
આજના દિવસે જહાનગતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે તમારે તમારા ટૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. રોજરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો.



એ મુસાફરીનો એકમાત્ર રસ્તો હતો.

દોડવાનું તેમના લોહીમાં કેવી રીતે વણાયેલું છે તે વિશે ૮૩ વર્ષીય વડીલ વસાવાએ વધુમાં જણાવ્યું કે, ૮૩ વર્ષીય વૃદ્ધ કહ્યું, “હાલ અમારી પાસે વાહનોની સુવિધા સરળ છે છતાં, હું સાદગીભર્યા જીવનમાં માનું છું. હું હજી પણ ચાલવાનું પસંદ કરું છું અને મેરેથોન દોડવું મારો શોખ બની ગયો છે. હું ૮-૧૦ વર્ષથી મેરેથોનમાં ભાગ લઈ રહ્યો છું. મારી પૌત્રી મારી સાથે દોડની સ્પર્ધાઓમાં ભાગ લે છે. મારો પુત્ર એક ઉત્સુક દોડવીર છે. તેણે યુએસએ અને ભારતમાં લગભગ ૧૫ ફૂલ મેરેથોનમાં ભાગ લીધો છે. તેથી, મેરેથોન દોડ અમારા લોહીમાં વણાયેલ છે.”

૨૧ યુરોપિયન દેશોની ૭૩ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ યુરોપિયન હાયર એજ્યુકેશન વર્ચ્યુઅલ ફેરમાં ભાગ લેશે



। નવી દિલ્હી, તા.૨૧ ।
યુરોપિયન હાયર એજ્યુકેશન વર્ચ્યુઅલ ફેર (EHEVF) ઈન્ડિયાની ૮મી આવૃત્તિ ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ ૩૮ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ <https://study-europe.n/register> દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને અગ્રણીઓ યુરોપિયન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડશે. બલ્ગેરિયા, સાયપ્રસ, ચેકિયા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઈટાલી, લિથુઆનિયા, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્પેન અને સ્વીડન સહિત ૨૧ યુરોપિયન યુનિયન (EU) સભ્ય દેશોમાંથી ૭૩ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ફેરમાં હાજર રહેશે. વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને કારણે યુરોપ માં ઉચ્ચ શિક્ષણ ભારતીય વિદ્યાર્થીઓમાં વધુને વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. યુરોપમાં ઉચ્ચ શૈક્ષણિક ધોરણો ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓ પણ દેશોની સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને કારણે સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ મેળવવા માટે તૈયાર છે. ભારતીય વિદ્યાર્થીઓમાં કેટલાક લોકપ્રિય અભ્યાસક્રમો એન્જિનિયરિંગ, કાયદો, દવા, ગણિત, કોમ્પ્યુટર અને ડેટા સાયન્સ, બિઝનેસ, ફાઈનાન્સ,



ભરતભાઈ પંડ્યા દિવાડા કોલોની, તા.૨૧

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર રાષ્ટ્રીય ગ્રંથ સમાહ વર્ષ ૨૦૨૩ હેઠળ શ્રી ચિત્રકુમાર સુધાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ ગ્રંથ સમાહ વર્ષ ની સરકારી તાલુકા પુસ્તકાલય કડાણા ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી પ્રકાશભાઈ જોષી, શ્રીમતી કોમલબેન ઉપાધ્યાય, શ્રી સંજયભાઈ ખાંટ, શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી જયપ્રકાશભાઈ પંડ્યા, શ્રી યશવંતભાઈ ભટ્ટ, શ્રી માનવેન્દ્રભાઈ જોષી, શ્રી વસંતભાઈ જોષી, શ્રી અચિનભાઈ જોષી, શ્રીમતી ભાનુબેન જોષી, શ્રીમતી ભદ્રશીલાબેન જોષી, શ્રીમતી ઈશિતાબેન જોષી, તેમજ ગાયના અનેક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવને લઈ ભક્તોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ વણકતળાઈ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આવેલ શ્યામ બાબાનું ચમત્કારિક મંદિર સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરતું હોવાનો શ્યામ પ્રેમીઓમાં દ્રઢ વિશ્વાસ

। ઝાલોદ, તા.૨૧ ।

ઝાલોદ નગરમાં કાર્તિક સુદ અગ્યારસના રોજ બાબા શ્યામનો જન્મોત્સવ આવી રહેલ છે. આ જન્મોત્સવ તારીખ ૨૩-૧૧-૨૦૨૩ ગુરુવારના દિવસે વણકતળાઈ હનુમાનજી મંદિરમાં આવેલ પ્રાંગણમાં બાબા શ્યામનો જન્મોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવનાર છે. શ્યામ પ્રેમીઓ બાબા શ્યામનો જન્મોત્સવ ઉજવવા માટે શનગની રહેલ છે. દાહોદ જિલ્લામાં બાબા શ્યામનું એક માત્ર મંદિર ઝાલોદ નગરમાં હોવાથી મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો જન્મોત્સવ નિમિત્તે યોજનાર જાહેર ભજન સંધ્યાનો લાભ લેવા સહુ શ્યામ પ્રેમીઓને જાહેર આમંત્રણ છે. ઝાલોદ નગરનું શ્યામ



મંદિર ચમત્કારિક અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવું દરેક શ્યામ ભક્તોનું માનવું છે. બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ મંદિરે ફૂલો તેમજ ફુગ્ગા થી ભવ્ય સજાવટ કરવામાં આવનાર છે. બાબા શ્યામનું ભવ્ય દરબાર, અખંડ જ્યોત દર્શન, બાબા શ્યામના ભજન, માવાના કેક થી જન્મ દિવસની ભવ્ય ઉજવણી,

છપ્પન ભોગ, ભજન સંધ્યા દરમિયાન પુષ્પ વર્ષા જેવા અનેક કાર્યક્રમો શ્યામ ભક્તો દ્વારા યોજનાર છે. બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે બાબા શ્યામના ભજનોની રમઝટ દરમિયાન દરેક શ્યામ પ્રેમીઓ શ્યામ બાબાના મંદિરમાં નાચી ઝૂમી બાબા શ્યામને રીઝવવા શનગની રહેલ છે. આ ભવ્ય પ્રોગ્રામમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્યામ ભક્તો મોટા પ્રમાણમાં આવનાર છે. દરેક શ્યામ પ્રેમી બાબાના જન્મોત્સવ નિમિત્તે બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે રાખેલ જાહેર પ્રોગ્રામનો લાભ લઈ બાબા શ્યામના આશીર્વાદ મેળવે તેવું નગરના શ્યામ પરિવાર તરફથી જાહેર આમંત્રણ છે.

રાજકારણીઓથી લઈને રમતવીરો સુધી, સિનેસ્ટાર્સથી લઈને સામાન્ય માણસ સુધી બધાએ સહારાશ્રીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી

। લખનો, તા.૨૧ ।

ભારતના સૌથી મોટા સમૂહમાંના એક સહારા ઈન્ડિયા પરિવારના મેનેજિંગ વર્કર અને ચેરમેન, સુબ્રત રોય સહારા, જેઓ પ્રેમથી સહારાશ્રી તરીકે જાણીતા હતા, તેમણે તમામ ક્ષેત્રના લોકો તરફથી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ પ્રાપ્ત કરી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માનનીય શ્રી યોગી આદિત્યનાથે સહારાશ્રીના અવસાન પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે આ રાજ્ય અને આપણા દેશની ભાવનાત્મક ખોટ છે કારણ કે સહારાશ્રી માત્ર સફળ જ નથી. ઉદ્યોગપતિ પણ એક મોટા હૃદયની વ્યક્તિ જેણે અસંખ્ય વ્યક્તિઓને મદદ કરી અને ટેકો આપ્યો.



૧૬મી નવેમ્બરે અંતિમ સંસ્કાર થયા હતા. દુઃખની આ ઘડીમાં તેમના પત્ની શ્રીમતી. સ્વપ્ના રોય, પુત્રવધૂ શ્રીમતી. રિયા રોય - તેમના મોટા પુત્ર શ્રી સુશાંતે રોયની પત્ની અને શ્રીમતી. યાંત્રીની રોય - નાના પુત્ર શ્રી સીમંતે રોયની પત્નીએ હજારો લોકો તરફથી અત્યંત ભાવનાત્મક સંવેદના પ્રાપ્ત કરી. સહારા ઈન્ડિયા પરિવારના પ્રવક્તાએ કહ્યું કે આ દુઃખની ક્ષણે સહારા ઈન્ડિયા પરિવારના ડેપ્યુટી મેનેજિંગ વર્કસ શ્રી ઓ.પી. શ્રીવાસ્તવ અને શ્રી જે.બી. રોય - સુબ્રત રોય સહારાના નાના ભાઈએ પરિવાર અને સમગ્ર સહારા ઈન્ડિયા પરિવારને પૈતૃક સહાય પૂરી પાડી છે.

મેષ (અ,લ,ઇ) : આજના દિવસે થોડી મોજ-મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. તમારી જાતને મોટા શુભ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવાડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીર્વાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખલેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો.

મિથુન (ક,ઇ,ઘ) : આજના દિવસે જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્ત્રીક્ષ્મથી દૂર રહો. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળી એવી શક્યતા છે.

કર્ક (ડ,ઢ) : આજના દિવસે સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતા વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે.



બેંક વેકેર સિનિયર સિટીઝન એફડી સ્કીમની સમયમર્યાદા લંબાવી

1 નવી દિલ્હી, તા. ૨૧ । દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંક વેકેર સિનિયર સિટીઝન એફડી સ્કીમની સમયમર્યાદા લંબાવી છે. હવે ગ્રાહકોને આ યોજનાનો લાભ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી મળતો રહેશે. બેંક તરફથી, ગ્રાહકોને આ સ્કીમમાં સામાન્ય FDની સરખામણીમાં વધુ વ્યાજનો લાભ મળશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ એફડી સ્કીમને અગાઉ ઘણી વખત લંબાવી હતી. SBI WeCare સિનિયર સિટીઝન FD સ્કીમ મે ૨૦૨૦ માં શરૂ કરવામાં આવી હતી અને તે સમયે તેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર ૨૦૨૦ હતી, જે ત્યારથી ઘણી વખત લંબાવવામાં આવી છે. SBIએ સ્પેશિયલ FD સ્કીમ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોને તેમની ફિક્સ ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવાનો હતો. વરિષ્ઠ નાગરિકોને આ યોજના પર ૩૦ bps વ્યાજનો લાભ મળે છે (વર્તમાન ૫૦ bps પ્રીમિયમ કરતાં વધુ). ફિક્સ ડિપોઝિટ માટે, વ્યાજ માસિક/ત્રિમાસિક અંતરાલ પર ચૂકવવામાં આવે છે. નોંધનીય છે કે SBIએ વેકેર FD સ્કીમની સમયમર્યાદા અગાઉ પણ ઘણી વખત લંબાવી છે. આવી સ્થિતિમાં, આશા છે કે બેંક ફરી એકવાર તેને આગળ વધારી શકે છે. જ્યારે બેંકની સામાન્ય FD યોજનામાં વરિષ્ઠ નાગરિકોને ૭ દિવસથી ૫ વર્ષની FD પર ૩.૫૦ ટકાથી ૭.૦૦ ટકા સુધીના વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. બેંકની અમૃત કલશ યોજના હેઠળ ગ્રાહકોને ૪૦૦ દિવસની FD પર ૭.૬૦ ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે હમાસના નેતાનો દાવો હમાસ ઈઝરાયેલ સાથે યુદ્ધ વિરામ કરારની નજીક

1 ગાઝા, તા. ૨૧ । હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરારની નજીક છે. હનીયેહે સોશિયલ મીડિયા પોસ્ટ ટેલિગ્રામ પર આ નિવેદન જારી કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ સંકેત આપ્યા હતા કે અપહરણ કરાયેલા બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર કતાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહ્યો છે. હમાસની રાજકીય પાંખની ઓફિસ પણ કતારમાં છે. કતારના પીએમએ રવિવારે કહ્યું હતું કે હમાસ દ્વારા અપહરણ કરાયેલ



ઈઝરાયેલી બંધકોની મુક્તિ અને ટૂંકા ગાળાના યુદ્ધવિરામ પર ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે પરંતુ તે કેટલાક મુદ્દાઓ પર અટવાયેલો છે. સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આનો સંકેત આપ્યો હતો. વાસ્તવમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટેનો સોદો ટૂંક સમયમાં થઈ શકે છે, ત્યારે બાઈડેને કહ્યું, 'મને એવું લાગે છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે સમજૂતી હેઠળ ઈઝરાયેલ પાંચ દિવસ માટે યુદ્ધવિરામનું પાલન કરશે અને આ દરમિયાન જમીન પર યુદ્ધવિરામ રહેશે.

બ્રિટનના વડાપ્રધાનના સિનિયર એડવાઈઝરના ગંભીર આક્ષેપ સુનકે કોરોના કાળમાં કહ્યું હતું, લોકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવાં સારા

પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે, વાલેસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે

1 લંડન, તા. ૨૧ । બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું 'કોરોના કાળમાં લોકોને મરવા દેવા' અંગેનું નિવેદન સામે આવ્યા બાદ બ્રિટનમાં વિવાદ શરૂ થઈ ગયો છે. સુનકનું ૩ વર્ષ જુનું નિવેદન હવે સામે આવ્યા બાદ રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝરે સુનકના સીનિયર એડવાઈઝરને ટાંકીને મીડિયા રિપોર્ટમાં મોટો દાવો કર્યો છે, જેમાં કહેવાયું છે કે, કોરોના મહામારી દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે, 'લોકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવાં સારા'. મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે. વાલેસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે. વાસ્તવમાં કોરોના મામલે યોજાયેલી બેઠકમાં કમિન્સે પૂછ્યું કે, રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવું જોઈએ કે નહીં? જેના પર સુનકે કહ્યું હતું કે, લોકડાઉન લગાવ્યા કરતા સારુ એ છે કે, કેટલાક લોકોને મરવા દો. વાલેસે ૪ મે-૨૦૨૦ના રોજ યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો છે. ઋષિ સુનકે જ્યારે આ નિવેદન આપ્યું હતું, ત્યારે વાલેસે ચાન્સેલર હતા. વાલેસે સુનક અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો બાદ બ્રિટનમાં રાજકીય પ્રવક્તાએ કહ્યું કે, પુરાવા સામે આવ્યા બાદ વડાપ્રધાન નિવેદન આપશે. ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં કોરોનામાં ૨.૨૦ લાખથી વધુના મોત થયા હતા. જાન્યુઆરી-૨૦૧૯ બાદ કોરોનાએ વિશ્વભરમાં કહેર વરસાવ્યો હતો. આ વૈશ્વિક મહામારીના કારણે વિશ્વભરમાં કરોડો લોકોના મોત થયા હતા અને ઘણા દેશોમાં લાંબા સમય સુધી લોકડાઉન રહેતા લોકો પોતાના ઘરમાં કેદ રહ્યા હતા.

યમનના હુતી બળવાખોરોએ આ રીતે ઈઝરાયેલી જહાજ કચું હાથજેક

1 નવી દિલ્હી, તા. ૨૧ । યમનના ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ શિપ હાર્જેકનો વીડિયો જાહેર કર્યો છે. ઈઝરાયેલ ડિકેન્સ ફોર્સિસએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુતી વિદ્રોહીઓએ યમન નજીક દક્ષિણી લાલ સમુદ્રમાં તુર્કીથી ભારત તરફ જતા કાર્ગો જહાજને હાર્જેક કર્યું હતું. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઈઝરાયેલ સાથેના સંબંધોને કારણે જહાજને કબજે કર્યું છે અને ગાઝાના હમાસ શાસકો સામે ઈઝરાયેલની ઝુંબેશના અંત સુધી આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈઝરાયેલની માલિકીના જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા ડ્રાઈવરને બંધક બનાવવામાં આવે છે. બાદમાં તેઓ વહાણને આગળ લઈ જાય છે. કેટલીક બોટ પણ નજીકમાં જતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વિદ્રોહી સંગઠન હુતીને ઈરાનનું સમર્થન પણ છે. રવિવારે, હુતી વિદ્રોહીઓએ સમુદ્રની મધ્યમાં તરતા કાર્ગો જહાજ 'ગેલેક્સી લીડર' પર હેલિકોપ્ટર દ્વારા ઉતાર્યા હતા. તેઓએ ૨૫ કૂ મેમ્બર્સને બંધક બનાવ્યા અને આખા જહાજને કબજે કરી લીધું. તેની સાથે તેઓ યમનના એક બંદરે પહોંચ્યા. હુતીએ એક નિવેદન જારી કરીને આ જહાજના અપહરણની જવાબદારી લીધી છે. યમને વિડિયો ફૂટેજ બહાર પાડ્યું છે જેમાં હુતીઓએ લાલ સમુદ્રમાં ઈઝરાયેલના ધ્વજવાળું જહાજ કબજે કર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યમનના હુતીઓએ તેમના લડવૈયાઓને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જહાજ પર ઉતાર્યા અને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધા. જહાજવામાં આવ્યું કે આ જહાજ પર યુકેન, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ અને મેક્સિકો સહિત ઘણા દેશોના કૂ મેમ્બર્સ હાજર હતા.

સેન્સેકસમાં ૨૬૬ અને નિફ્ટીમાં ૮૮ પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

1 નવી દિલ્હી, તા. ૨૧ । શેરબજારનો કારોબાર મંગળવારે ઊછાળા સાથે બંધ થયો. બીએસઈસેન્સેકસ ૨૬૬ પોઈન્ટ વધીને ૬૫૮૨.૧ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઈન્ટ વધીને ૧૯૭૮૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને બીએસઈ સ્મોલ કેપમાં નજીવો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી આઈટી થોડી નબળાઈ પર બંધ થયો હતો, નિફ્ટી બેંકમાં પણ નજીવો વધારો નોંધાયો હતો. વિદેશી રોકાણકારોની ખરીદીને કારણે મંગળવારે શેરબજારમાં ઊછાળો નોંધાયો હતો. જોકે, શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે વિદેશી રોકાણકારોની ઉદાસીનતાના



કારણે બજારમાં કરેકશન જોવા મળી શકે છે. શેરબજારના ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં વધારો નોંધાયો હતો જ્યારે કોલ ઈન્ડિયા લિમિટેડ, ઓએનજીસી, બીપીસીએલ અને

એલટીઆઈ માર્ન્ડ ટ્રીના શેરમાં નબળાઈ નોંધાઈ હતી. મંગળવારે શેરબજારના ટ્રેડિંગના બંધ સમયે, બીએસઈસેન્સેકસ ૩૦૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૮૦૦ ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ટાટા ટેકનો આઈપીઓ બુધવારે ખુલવા જઈ રહ્યો છે અને ઘણા બ્રોકરેજોએ ટાટા ટેકના આઈપીઓ સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. આનંદ રાહી વેલ્થ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, આઈઆઈએફએલફાઈનાન્સ, મેસ ફાઈનાન્સિયલ સર્વિસિસ, ઈન્ડિયાબુલ્સ ફાઈનાન્સ, પીએમબીહાઈસિંગ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિસ, ધાની સર્વિસિસ અને મન્નાપુરમ ફાઈનાન્સમાં મંગળવારના વેપારમાં નબળાઈ જોવા મળી હતી. મન્નાપુરમ ફાઈનાન્સને પાછળ છોડીને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની IIFL ફાઈનાન્સ દેશની બીજી સૌથી મોટી ગોલ્ડ લોન પ્રોવાઈડર કંપની બની છે. કંપનીનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ. ૨૩૬૮૦ કરોડને પાર કરી ગયો છે. મન્નાપુરમ ફાઈનાન્સનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ. ૨૦૮૦૯ કરોડનો છે. શેરબજારમાં મલ્ટિબેગર રિટર્ન આપતા શેરો વિશે વાત કરીએ તો, પટેલ એન્જિનિયરિંગ, જિયો ફાઈનાન્સિયલ, ઓમ ઇન્ફ્રા, દેવયાની ઈન્ટરનેશનલ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં વધારો નોંધાયો હતો.

યુવાનોમાં વધેલા હાર્ટએટેક મામલે આઈસીએમઆરનો ખુલાસો લાઈફસ્ટાઈલમાં ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી

વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, જો કોઈએ વેક્સિનનો એક ડોઝ લીધો છે તો કોરોનાને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે

1 નવી દિલ્હી, તા. ૨૧ । કોવિડ-૧૯ મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યું હતું. દેશમાં લોકોને વેક્સિનના ૨ અરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર દેશમાં યુવાઓમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ક્યાંક આની પાછળનું કારણ વેક્સિન તો નથી ને. જોકે, હવે આઈસીએમઆરએ તેનો જવાબ આપ્યો છે. આઈસીએમઆરએ તાજેતરમાં એક સ્ટડી કરી છે. તેમાં આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો કે, શું કોવિડ વેક્સિન અને અચાનક થઈ રહેલા મોત વચ્ચે કોઈ સંબંધ છે? પોતાની સ્ટડી દ્વારા આઈસીએમઆરએ જણાવ્યું કે, ભારતમાં કોવિડ-૧૯ વેક્સિનના કારણે યુવાઓમાં અચાનક મૃત્યુનું જોખમ નથી વધ્યું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મોત થવાના

નાની ઉંમરમાં લોકો સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે

1 નવી દિલ્હી, તા. ૨૧ । એક સમય હતો જ્યારે સ્ટ્રોક એ વૃદ્ધોનો રોગ હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે સૌથી નાના લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. હવે સ્થિતિ એટલી ખરાબ છે કે તે દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. અભ્યાસ મુજબ, ૪૫ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં સ્ટ્રોકના કેસમાં લગભગ ૧૦ થી ૧૪ ટકાનો વધારો થયો છે. જેના કારણે તે ગંભીર ચિંતાનો વિષય છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગ - એરિથમિયા, લિપિડ ડિસઓર્ડર, સ્થૂળતા, ડાયાબીટીસ, ધૂમ્રપાન, આલ્કોહોલ પીવું અને શારીરિક નિષ્ક્રિયા - લોકોમાં સ્ટ્રોકનું જોખમ લગભગ ૫૦ ટકા જેટલું વધારે છે. તજાણ કેવી રીતે સ્ટ્રોકનું કારણ બને છે? તીવ્ર મનોવૈજ્ઞાનિક તજાણના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી ઘટનાઓની સાંકળ ઉભી થઈ શકે છે. ન્યુરોએન્ડોકાઈન ફંક્શનમાં સમસ્યા જેના કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે.

જર્મનીમાં કામ કરવા માટે ભારતીયોને તક જર્મનીમાં ઈમિગ્રેશનના નિયમો વધારે સરળ બનશે

જર્મનીને ભારત સહિતના દેશોમાંથી સ્કીલ વર્કર્સની જરૂર છે જેના કારણે ઈમિગ્રેશનના નિયમોમાં ઘણી રાહત આપવામાં આવી છે

1 નવી દિલ્હી, તા. ૨૧ । યુરોપના સૌથી શક્તિશાળી દેશ જર્મનીમાં અત્યારે આઈટી, ટેકનોલોજી, હેલ્થકેર, કોન્સ્ટ્રક્શન, લોજિસ્ટિક્સ સહિતના સેક્ટરમાં અનુભવી અને સ્કીલ લોકોની જરૂર છે. યુરોપિયન યુનિયન બહારના લોકો પણ આ સેક્ટરમાં કામ કરવા આવે તે માટે જર્મનીએ ઈમિગ્રેશનના નિયમો સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. જર્મનીની કંપનીઓ જુદા જુદા ક્ષેત્રોમાં વિદેશી વર્કર્સને લાવવા પ્રયાસ કરી રહી છે. પછી તે એન્જિનિયર હોય, નર્સ હોય કે બીજા ટેકનિકલ માણસો હોય. જર્મન સંસદે સ્કીલ ઈમિગ્રેશન એક્ટ પસાર કર્યો છે તેથી વિદેશી કામદારોને વધુ સરળતાથી લાવી શકાશે અને એન્ડ્રીનું કામ ઝડપી બનશે. જર્મનીએ નવા સ્કીલ વર્કર કાયદાનો પ્રથમ ફેઝ પૂરો કર્યો છે જેથી ઈયુ બ્લુ કાર્ડના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. તેના કારણે જર્મનીમાં સ્કીલ વર્કર્સ માટે તકમાં વધારો થશે. EU Blue Card સ્કીમમાં મુખ્ય ફેરફાર એ છે કે સેલેરીના ધોરણ નીચા કરવામાં આવ્યા



છે. એટલે કે અગાઉ કરતા નીચા પગારે પણ બહારના લોકોને કામ પર રાખી શકાશે. હવે પેન્શન ઈન્શ્યોરન્સ માટે વાર્ષિક કન્ટ્રીબ્યુશન એસેસમેન્ટ સિલિંગના ૪૫ ટકા જેટલી મિનિમમ સેલેરીનો નિયમ રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હોય તેવા લોકોને ઈયુ બ્લુ કાર્ડ મેળવવાની વધુ તક મળશે. જોકે, તેમાં મિનિમમ સેલેરીના નિયમનું પાલન કરવાનું રહેશે.

વિશેષ રાણીપુર ગ્રામજનોએ ઉખાભેર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું

રાણીપુરા ગ્રામજનોએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મને રસપૂર્વક નિહાળી

મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા માટે જાગૃત કર્યા

આદિજાતિ વિસ્તાર ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકલિધ ફલેગશીપ યોજનાકીય લાભોની માહિતી ધરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ - રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉપબળકારે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં

લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ટી.બી સ્ક્રીનીંગ, સિકલસેલનું સ્ક્રીનીંગ પણ હાથ ધરાવ્યું હતું. રાણીપુરા ખાતે વિકસિત ભારત સંકલ્પ

યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે, ગામના સરપંચ શ્રીમતી મિતાબેન વસાવા, ઉપસરપંચશ્રી તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રી વિશાલભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી જયશીલભાઈ પટેલ, લાઈઝન અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



પંચમહાલના ગોધરા હાઇવે પર વહેલી સવારે બે ખાનગી બસના અકસ્માત બસને પાછળથી અન્ય બસે મારી ટક્કર, ચાર મુસાફરોના મોત

અકસ્માતની જાણ થતા જ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અકસ્માતની જાણ થતા જ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો

ગોધરા, તા.૨૧ | પંચમહાલના ગોધરા હાઇવે પર આજે વહેલી સવારે બે ખાનગી બસના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૧ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોધરા દાહોદ હાઇવે પર અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસ બગડતા રોડ પર ઉભી રાખવામાં આવી હતી. ત્યારે ગોધરા તરફ જતી અન્ય એક ખાનગી બસે તેને પાછળથી ઘડાકાભેર અથાડી દીધી હતી. અથાડીને તે બસ રોડની સાઈડમાં ખાબકી ગઈ હતી. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેકનિકલ ખામી સર્જતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપ



મુસાફરોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મોટાભાગે શ્રમિક પરિવાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ગોધરા એસડીએમ પ્રવીણસિંહ જેતાવતે આ અકસ્માત અંગે જણાવ્યું છે કે, આજે વહેલી સવારે પરબડી ચોકડી પાસે એક બગડેલી બસ ઉભી હતી. પાછળથી દાહોદ બાજુથી એક બસ આવતી હતી. આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો છે અને તેમાં ચાર લોકોનો મોત નીપજ્યા છે અને

કુલ ૧૧ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક બાળક સહિત બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા છે. આ ઉપરાંતના ઈજાગ્રસ્તોને પ્રાઈમરી સારવાર આપીને તેમના પરિવાર સાથે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી સહિતની કાફલો ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દાહોદથી ગોધરા તરફ આવતા હાઇવે પર એક લકઝરી બસ બગડી જતા તેને રોડની એક બાજુએ પાર્ક કરીને પાર્કિંગ લાઈટ પણ ચાલુ રાખવામાં આવી હતી. જેથી દૂરથી જોઈ શકાય. તે છતાં પાછળથી એક લકઝરી બસ આવી અને ઉભેલી બસને અથાડીને ડાબી બાજુ ૧૦૦ ફૂટ દૂર લકઝરી અંદર ઉતારી દીધી હતી. જેના કારણે ચાર મુસાફરોના મોત નીપજ્યા છે અને અન્ય લોકોની સારવાર ચાલી રહી છે.

વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર એકઠા થયા ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો

ગાંધીનગર, તા.૨૧ |

વધુ એક આંદોલન ગાંધીનગરના દ્વાર સુધી પહોંચ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર એકઠા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો છે. પરંતુ વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. આ સમયે કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.



સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન ઉગ્ર કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો. વિદ્યા સહાયક સામેનો રોષ સતત ઉમેદવારોમાં વધી રહ્યો છે. જ્ઞાન સહાયક ભરતી ૨૬ કરી કાયમી ભરતી કરવાની માંગણી સાથે ટેટ પાસ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી પાસે ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા હતા. ત્યારે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતી સામે વિરોધ પ્રદર્શન કરતા જ ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત

કરાઈ હતી. ઉમેદવારોએ જણાવ્યું કે, પોલીસ ગમે તેટલી વાર અટકાયત કરશે. પણ અમારું આંદોલન ચાલુ જ રહેશે. કરાર આધારિત નહીં પણ કાયમી શિક્ષકોની ભરતી કરો. ટેટ પાસ ઉમેદવારોની માંગણી છે કે કરાર આધારિત નહિ પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે.

એપ્રિલ ૨૦૦૫ પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો ઠરાવ ન થતા આજે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરાયું હતું. આગામી રણનીતિ નક્કી કરવા માટે બેઠક કરાઈ હતી. ગયા વર્ષે સરકારે લાભ આપવાની જાહેરાત કર્યા બાદ ઠરાવ ન થતા શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. ઠરાવ ન આવતા શિક્ષકો જરૂર પડે તો આંદોલન કરશે તેવી ચીમકી આપી. જૂની પેન્શન યોજના અંગે રાજ્યના ૨૨ હજારથી વધુ શિક્ષકો આંદોલન કરી શકે છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે બાંધો યજાવવાના મૂડમાં છે. રાજ્ય સરકારે ગયા વર્ષે કરેલા સમાધાન સંદર્ભે વિરોધના સૂર પેદા થયા છે. વિવિધ માંગ કરાઈ છે.

વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં અનેક વેપારીઓ શિક્ષક થયા સુરત ડાયમંડ બુર્સમાં વ્યવસાયિક કામકાજના શ્રીગણેશ કરાયા મુંબઈના અનેક વેપારીઓ અને કંપનીઓ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે

સુરત, તા.૨૧ | સુરત ડાયમંડ બુર્સમાં આજથી અનેક ઓફિસોની થઈ શરૂઆત થઈ છે. મુંબઈના અનેક વેપારીઓ અને કંપનીઓ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે. આજથી વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં અનેક વેપારીઓ શિક્ષક થયા છે. આગામી દિવસોમાં કાર્યરત ઓફિસોની સંખ્યામાં વધારો થશે. અમુક ઓફિસોમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી આવનારા

રાજકોટમાંથી ફરી એક વાર દારુની બોટલો મળી આવી નાના મોવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારુની બોટલો મળી આવી આંગણવાડી કાર્યકરનો આરોપ છે વસાહતમાં રહેતા સ્થાનિકો ગંદકી ફેલાવી રહ્યા છે

રાજકોટ, તા.૨૧ | રાજકોટમાંથી ફરી એક વાર દારુની બોટલો મળી આવી છે. રાજકોટના નાના મોવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારુની બોટલો મળી આવી છે. એટલું જ નહીં આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. વરવી વાસ્તવિકતાના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે. કારણ કે જ્યાં ભૂલકાઓ ભવિષ્યનું ઘડતર થતું હોય ત્યાં ગંદકી કેવી રીતે ચલાવી લેવાય. રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોનો વિરોધ TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશને લઈ વિરોધ

સરકાર દ્વારા પરિપત્ર ૨૬ કરી TRB જવાનોની નોકરી રાખેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

સુરેન્દ્રનગર, તા.૨૧ | સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે ૪૦ ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.



રાજ્ય સરકાર દ્વારા ઈમ્ જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ શરૂ થઈ ચુક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા TRB જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે ૪૦ ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે TRB જવાનોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા પરિપત્ર ૨૬ કરી TRB જવાનોની નોકરી રાખેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સમગ્ર રાજ્યના

સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજીત કથાના પ્રથમ દિવસે માનનીય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબે લીલી જંડી આપી ભવ્ય શુભારંભ કરાવ્યો



ઓમકારસિંહ ચૌહાણ | સંતરામપુર, તા.૨૧ | આજરોજ શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા ની શુભારંભના ભાગરૂપે દિવ્ય અને ભવ્ય કળશ યાત્રા ની શુભ શરૂઆત ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિભાગ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઠ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના પટાગણમાં હજારો ભક્તો ની હાજરીમા લીલી જંડી આપી કળશ યાત્રા નું પ્રસ્થાન કરાવ્યું. હજારો કળશયાત્રી બહેનો તથા પોથીયાત્રી બહેનો ગામના ગ્રામજનો ગાયત્રી પરિવાર ના પરિવારજનો જોડાયા. કળશ યાત્રા પુરા સંતરામ પુર નગર માં ફરી કથા મંડપમાં આવી આરતી થયા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મારીસાથે ગાયત્રી પરિવાર ના અને પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાસીયા, સંતરામપુર તાલુકા મંડળ ના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ વળવાઈ, નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી હાટીલા જી, તેમજ પાટીના કાર્યકર્તાઓ સહીત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ જામ્યું અર્જુન રાઠવાની માહિતી ગેરમાર્ગે દોરનારી હોવાથી રામસિંગ રાઠવાની લિગલ પગલા લેવાની તૈયારી

છોટાઉદેપુર, તા.૨૧ | છોટાઉદેપુરમાં આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ જામ્યું છે. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઈકેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ છે. અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર રામસિંગ રાઠવા પર આરોપ કર્યા છે. જ્યાં ટ્રાઈકેડ મામલે અર્જુન રાઠવાએ સવાલ ઉઠાવ્યા હતા. જાહેર મંચ પરથી રામસિંગ રાઠવાએ કહ્યું કે, અર્જુન રાઠવાની માહિતી ગેરમાર્ગે દોરનારી છે. આ સાથે જ ખોટી માહિતી બદલ લીગલ એક્શન લેવાના રામસિંહ રાઠવાએ વાત કરી

છે. આમ, ટ્રાઈકેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસી નેતા અર્જુન રાઠવાની સોશિયલ મીડિયા યુદ્ધ હવે જાહેર મંચ પર આવી ચૂક્યું છે. તેજગઢ ખાતે ભાજપ ના સ્નેહ મિલન સમારોહમાં રામસિંગ રાઠવા દ્વારા અર્જુન રાઠવાનું નામ લીધા વિના તેઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. છોટાઉદેપુરના કોંગ્રેસી નેતા અને ભાજપના ટ્રાઈકેડના ચેરમેનનું સોશિયલ મીડિયા યુદ્ધ જાહેર મંચ પર આવી પહોંચ્યું છે. કોંગ્રેસના અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર કરેલા સવાલોના જવાબ ટ્રાઈકેડના ચેરમેન રામસિંગ રાઠવા દ્વારા તેજગઢ ખાતે ભાજપના સ્નેહમિલનમાં

જાહેર મંચ પરથી આપ્યા છે. અગાઉ રામસિંગ રાઠવાએ અર્જુન રાઠવાને ખોટી માહિતી આપવા અંગે માહિતી આપવાનું બંધ કરવા જણાવ્યું હતું. ચેતવણીમાં લિગલ એક્શન લેવા માટે પણ રામસિંગ રાઠવા જણાવ્યું હતું. રામસિંગ રાઠવાએ તેમના શાબ્દિક પ્રહારમાં અર્જુન તેજગઢ ખાતે જાહેર મંચ પરથી અર્જુન રાઠવાનું નામ લીધા વિના કહ્યું કે, એમનું દિમાગ છે કે કેમ તે મને ખબર નથી ભગવાને આપ્યું જ હશે બાકી આવું કોય બોલે નહીં. રામસિંગ રાઠવાએ જાહેર મંચ પરથી કરેલા શાબ્દિક પ્રહારના જવાબમાં અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું રામસિંગભાઈ ૨૭ વર્ષ સાંસદ રહી ચૂક્યા છે હાલ તેઓ રામસિંગ રાઠવાએ ભાજપના સ્નેહમિલન લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાને બદલે માત્ર અર્જુન રાઠવાની ગાળો આપવામાં સમય પસાર કર્યો છે. રામસિંગ રાઠવાને ટ્રાઈકેડના ચેરમેન તરીકે જે કામ કરવાનું હતું. વન ધન વિકાસ કેન્દ્રો ગુજરાતમાં શરૂ કરવાના હતા તે કાર્ય નહીં મારા સવાલોના જવાબ આપતા નથી અને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. રામસિંગ રાઠવા ખૂબ અનુભવી નેતા છે તેમ છતાં જાહેર મંચ પરથી ડરાવાની વાતો કરે નિગલ કાર્યવાહીની વાતો કરે છે.

ભક્તો હવાઈ મુસાફરી કરી પુષ્પવર્ષા કરી શકે, તેવું આયોજન કષ્ટભંજન દાદાને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો અનોખો લ્હાવો

ભોટાદ, તા.૨૧ | મહોત્સવમાં ભક્તો હવાઈ મુસાફરી કરી પુષ્પવર્ષા કરી શકે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો સામાન્ય કિંમતથી હેલિકોપ્ટરમાં બેસી સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરે છે. કિંગ ઓફ સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરે છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી શકી છે અને પુષ્પવર્ષા પણ કરી શકે છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં અનોખું આયોજન થયું છે. મહોત્સવમાં ભક્તો હવાઈ મુસાફરી કરી

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક સમાચાર પત્ર

ઉપાડો ફોન 9800708900

આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો

અપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વીડીઓ મોકલી આપો

દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આપરી લેતુ અખબાર “ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત” દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો...

cnngujarat@gmail.com